

## Kalana ispat limited

Registered Office : C-918, Venus Stratum, Nr. Jhansi Ki Rani Statue, Nehrunagar, Ahmedabad-380015, Phone : 079-49208045 E-MAIL ID : kalanaispat2015@gmail.com Website : www.kalanaispat.com Factory Address: Sy. No. 4/1/A, Sanand-Viramgam Highway, Village-Kalana, Tal- Sanand, Dist.- Ahmedabad, Gujarat India.

Date: 03.09.2025

To,
The Manager,
Listing Departments
National Stock Exchange of India Limited,
Exchange Plaza, C-1, Block G,
Bandra Kurla Complex,
Bandra (E) Mumbai – 400051

**NSE SYMBOL: KALANA** 

<u>Subject: Newspaper Publication- Disclosure Under Regulation 30 And 47 Of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.</u>

Dear Sir/Madam,

Pursuant to Regulation 30 and Regulation 47 of SEBI Listing Regulations, we enclose herewith the copies of Newspaper publication published in "Financial Express" (English) and "Financial Express" (Gujarati Edition) dated 03.09.2025 intimating that 13<sup>th</sup> Annual General Meeting of the Company will be held on Saturday, 27<sup>th</sup> September, 2025 at 12.30 P.M.(1ST) through Video Conferencing/ Other Audio-Visual Means. The publication also includes details about Book closing of the Company, Dividend, e-Voting details etc.

This is for your information and records.

Please acknowledge the receipt.

Thanking you.

Yours sincerely,

For and Behalf of Kalana Ispat Limited

Varghese Joseph Pottakerry Managing Director DIN: 02771578 **FINANCIAL EXPRESS** 

## यूनियन बैंक 🕥 Union Bank

Assets Recovery Branch: Union Bank Bhavan, Forth Floor,

Race Course Road, Opp. Indoor Stadium, Rajkot. [Rule 8(1)] POSSESSION NOTICE

Whereas The undersigned Sh. Gunjan Sharma being the Authorised Officer of the Union Bank of India, Bhavnagar Main Branch at Sopan, Waghawadi, Opp Takhteshwar Post Office, Bhavnagar, Gujarat - 364 002 under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act No. 54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated 06.02.2025 calling upon the Borrower / Co-Borrower Mr. Bhagirath N. Trivedi and Mrs. Niharikaben Bhagirathbhai Trivedi to repay the amount mentioned in the notice being Rs. 31,86,500.94/- (Rupees Thirty One Lakhs Eighty Six Thousand Five Hundred Ninety Four Paise) plus further interest and other charges within 60 days from the date of receipt of the said notice.

The Borrower / Co-Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the Public in General that the undersigned has taken **Possession** of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with rule 8 of the said Rules on this 2nd Day of

The Borrower / Co-Borrower in particular and the Public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Union Bank of India for an amount of Rs. 31,86,500.94/- plus further interest and

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to the borrower to redeem the secured assets.

## Description of Immovable Property

All that Part of the Property consisting of Plot No. 167 paiki Admeasuring 80.39 Sq. Mtrs. (Eastern Part of the Whole Plot) situated on Ghogha Road, Opp. Swaminarayan Gurukul, Akawada, Revenue Survey No. 104 paiki, at Gitanagar, Bhavnagar. Owned by Mr. Bhagirath N. Trivedi and Mrs. Niharikaben Bhagirathbhai. Bounded : On the North by : 6 Mts. Wide Road, On the South by : Adjoining Plot No. 166, On the East by : Plot No. 169, On the West by : Other Part of Plot No. 167

Date: 02.09.2025, Place: Bhavnagar Sd/- Authorised Officer, Union Bank of India

## griwise AGRIWISE FINSERV LIMITED (ESRTWHILE STAR AGRI FINANCE LIMITED) New Reg. Office:Unit No.802,8th Floor Sumer Plaza, Marol, Maroshi

Nagar, Marol Nanka, Mumbai, Andheri East-400059 POSSESSION NOTICE [(Appendix IV) Rule 8(1)] Whereas the Authorized officer of Agriwise Finsery Limited formerly known as StarAgri Finance

Limited, a Non-Banking Financial Company under the provision of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) (hereinafter referred to as "Act") having its Registered Office at 601,6th Floor, Sahar Plaza Complex, Bonanza International, Andheri Kurla Road, Near J B Nagar Metro Station, Chakala Andheri (East), Mumbai- 400059 (hereinafter referred to as "Morgagee") and in exercise of the powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rule, 2002 issued a Demand Notice dated 17-06-2025 calling upon; The Borrower, Co-Borrowers and security providers i.e. (1) Mr. SURESHBHAI MEGHJIBHAI OGANJA (Borrower) 257, OLD PLOT AREA, WATER TANK STREET AT: DAHINSARDA, - 360110 TAL: PADDHARI, RAJKOT, GUJRAT, Also, At: PLOT No. 1, NORTH SIDE, WATER TANK STREET, DAHISANDRA- 360110, TAL- PADDHARI, RAJKOT, GUJRAT (2) Mrs. BHARTIBEN SURESHBHAI OGANJA (Co Borrower) 257, OLD PLOT AREA, WATER TANK STREET AT: DAHINSARDA, - 360110 TAL: PADDHARI, RAJKOT, GUJRAT to repay the amount mentioned in the notice being Rs. 20,01,427,00/- (Twenty Lakh One Thousand Four Hundred Twenty-Seven Rupees Only) due as on 16-06-2025 along with the applicable interest and other charges within 60 days from the date of receipt of the said notice.

"The borrower/Guarantor having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) And of Section 13 of Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this the 01ST day of September, 2025

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of 'Agriwise Finsen Limited formerly known as StarAgri Finance Limited" for an amount of Rs. 20,01,427.00/-(Twenty Lakh One Thousand Four Hundred Twenty-Seven Rupees Only) due as on 16-06-2025 along with the applicable interest and other charges.

"The attention of borrower is invited to provisions of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured asset.

#### SCHEDULE - I **DETAILS OF SECURED ASSETS**

Constructed Residential Property Measuring 391.12.30 Sq Mtrs, Gamtal North Side of Plot No Situated at Dahisarda (Aii) Tal: Paddhari-, Dis-Raikot, Guirat, Boundaries of Property: North.

Survey No.39, South - Plot No-2, East - Road, West - Road **Authorized Officer** Dated: 01 /09/2025 Agriwise Finserv Ltd. Formerly Place: Dahisarda (Aji) Known as StarAgri Finance limited

Remus -- REMUS PHARMACEUTICALS LIMITED

Corporate Identification Number: L24232GJ2015PLC084536 Regd. Office: 1101 to 1103, South Tower, One 42, B/H Ashok Vatika, Nr. Jayantilal Park BRTS, Ambli Bopal Road, Ahmedabad - 380054, Gujarat, India | Telephone: +91-79-29999857

#### Website: www.remuspharma.com | E-mail: cs@remuspharma.com **NOTICE OF TENTH (10TH) ANNUAL GENERAL MEETING & E-VOTING INFORMATION**

Notice is hereby given that the Tenth (10") Annual General Meeting ("AGM") of the Members of Remus Pharmaceuticals Limited (the "Company") is scheduled to be held on Thursday, September 25, 2025 at 11:30 A.M. (IST) through Video Conferencing ("VC")/Other Audio Visual Means ("OAVM") facility in compliance with Circulars issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and Circulars issued by the Securities and Exchange Board of India ("SEBI Circulars") to transact the businesses as set forth in the Notice of the AGM of the Company.

In compliance of the MCA Circulars and SEBI Circulars, the Notice of the AGM along with the Annual Report of the Company for the Financial Year 2024-25 have been sent electronically through email to the Members whose email addresses are registered with the Company or the depositories/depository participants. Further, a letter providing the web link, including exact path where the complete details of the Notice of AGM and Annual Report are available, has been sent to those shareholders whose e-mail addresses are not registered. The Members who wish to obtain printed copies of the abovementioned documents can e-mail their request at cs@remuspharma.com by mentioning their name, address along with PIN code and Folio No. / DP ID & Client ID.

The aforesaid documents will also be available on the website of the Company at www.remuspharma.com, the website of Stock Exchange i.e. National Stock Exchange of India Limited at www.nseindia.com and on the website of MUFG Intime India Private Limited ("MUFG"/"RTA").

As per Section 108 of the Companies Act, 2013 and Rule 20 of the Companies (Management & Administration) Rules, 2014, as amended, and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015, the Company is pleased to provide its Members the facility of remote e-voting in respect to the businesses to be transacted at the AGM through electronic means. The Company has engaged the services of MUFG as authorized agency to provide remote e-voting facility.

The details regarding remote e-voting and e-voting during AGM are as under: 1. Detailed instructions for remote e-voting; e-voting during the AGM; attending

the AGM through VC/OAVM and registration of e-mail address, are available in the Notice of the AGM.

Date and time of commencement of remote e-voting: Monday, September 22,

2025 (09:00 A.M. IST) Date and time of end of remote e-voting: Wednesday, September 24, 2025

Aperson, whose name appears in the register of members/beneficial owners as on the Cut-off date i.e. Thursday, September 18, 2025 shall only be entitled to

avail the facility of remote e-voting as well as e-voting at the meeting. A person, whose name appears in the register after dispatch of the Notice of the meeting and holding shares as on the cut-off date, may obtain the USER ID and PASSWORD for remote e-voting and voting at AGM through e-voting by following the detailed procedure as provided in the Notice of the meeting which

is available on the Company's website and MUFG website. If the member is already registered with MUFG for e-voting then he can use his existing USER ID and PASSWORD for casting the vote through remote e-voting and voting at AGM through e-voting. A facility of voting through e-voting shall also be made available at the AGM and

members attending the meeting who have not already cast their vote by remote e-voting shall be able to exercise their rights to e-vote at the meeting.

The members who have casted their vote by remote e-voting prior to the meeting may attend the meeting but shall not be entitled to cast their vote again. Members holding shares in electronic form may update/register their e-mail

address to their Depository Participant. Aperson who is not a member as on the Cut-off date, should consider this Notice for information purpose only.

10. Members are requested to note that a dividend of Rs. 0.50/- per equity share has been recommended by the Board of Directors for the Financial Year ended on March 31, 2025, subject to the approval of the members at the ensuing AGM. Dividend, if declared, at the AGM, will be paid within 30 days of declaration, to those members whose names appear in the Register of Members/Beneficial Owners furnished by National Securities Depository Limited and Central Depository Services (India) Limited, as at the close of the business hours on Thursday, September 18, 2025 being the Record Date for identifying eligible

 In case of any queries/grievances related to remote e-voting, the members/beneficial owners may refer FAQs and InstaVote e-voting manual available at https://instavote.linkintime.co.in/ or write an e-mail to enotices@in.mpms.mufg.com or call on 022-49186000.

shareholders.

Date: September 02, 2025

Place: Ahmedabad

For Remus Pharmaceuticals Limited

Arpit Deepakkumar Shah **Managing Director** 

DIN: 07214641

Date: 01.09.2025

Place: Vadodara

Bhavnagar Main Branch: Amba Chowk, P.B. No. 37, Nr. Nareshvar बैंक ऑफ़ इंडिया BOI Mandir, Bhavnagar - 364 001

APPENDIX-IV [See Rule 8(1)] POSSESSION NOTICE (For Immovable Property)

Whereas The undersigned being the authorised officer of the Bank of India under he Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated 30.06,2025 calling upon the Borrower/s Mr. Ravishankar Mohanlal Devani and Mrs. Chandraben Mohanial Devani to repay the Amount mentioned in the notice being Rs. 10,19,406/- (In words Rupees Ten Lakh Nineteen Thousand Four Hundred Six) within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the Public in General that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest. Enforcement) Rules, 2002 on this the 2nd day of September of the year 2025. The Borrower in Particular and the Public in General is hereby cautioned not to deal

with the property and any dealings with the property will be subject to the charge of the Bank of India for an amount Rs. 10,19,406/- and interest thereon. The Borrower's attention is invited to provisions of sub-section (8) of section

13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the Immovable Property Ground Floor Flat No. M-6535, Admeasuring 51.00 Sq. Meters in Shivranjani Flat of Gujarat Housing Board -192 MIG Scheme on N.A. Land of Tarsamiya R.S. No. 77/2, Situated at Gayatrinagar, Bhaynagar, District, Bhaynagar-364001 in Name of Mr. Ravishankar Mohanlal Devani and Mrs. Chandraben Mohanlal Devani Vide Sale Deed No. 1021 Dated 24.02.2021. The said Property is Bounded as under: East: Open Space, West: Stair Case and Flat No. 6536. North: Flat No. 6534. South:

Open Space Date: 02.09.2025, Place: Bhavnagar

Chief Manager & Authorized Officer, Bank of India

## KALANA ISPAT LIMITED

CIN: L27100GJ2012PLC072306 Registered Office Address: C 918 Venus Startum Nr Jhansi ki Ran, Nehrunagar, Azad Society, Ahmedabad, Gujarat, India, 380015 Phone: +91- 81418 48159, Email: compliance@kalanaispat.com

NOTICE OF THE 13th ANNUAL GENERAL MEETING. E-VOTING & BOOK CLOSURE INFORMATION

Notice is hereby given that the 13th Annual General Meeting (AGM) of the Members of Kalana Ispat Limited will be held on Saturday, 27th September, 2025 at 12:30 P.M. IST through Video Conferencing (VC)/other Audio Video Conferencing (OAVM) to transact the businesses as set out in the Notice dated 1st September, 2025.

Website: www.kalanaispat.com

In compliance with the MCA and SEBI Circulars, Electronic copies of the Notice of the AGM and Annual Report of the Company for the Financial Year 2024-2025 have been sent to those Members whose e-mail addresses are registered with the Company/Depositories. These documents are also available on the website of the Company and can be downloaded from the website www.kalanaispat.com, on the website of stock exchange i.e. National Stock Exchange of India Limited at www.nseindia.com and on the website of the company at www.kalanaispat.com. The dispatch of Notice of the AGM through emails has been completed on 1st September, 2025. Members attending the AGM through VC/OAVM shall be reckoned for the purpose of quorum under Section 103 of the Act.

The remote e-voting period commences on Wednesday, 24th September, 2025 at 9.00 A.M. and ends on Friday, 26th September, 2025 at 5.00 P.M. During this period, members of the Company holding shares in dematerialized form, as on the cut-off date of 21st September, 2025 may cast their vote by remote e-voting on the business specified in Notice of the AGM dated 01st September, 2025. Any person, who acquires shares of the Company and becomes Member of the Company after dispatch of the soft copy of Notice and Annual Report after the cut-off date i.e. 21st September, 2025 may follow the same procedure for remote e-voting. The remote e-voting module shall be disabled by National Securities Depository Limited for voting thereafter. Once the vote on a resolution is cast by the members, the member shall not be allowed to change it subsequently.

Members who are participating in the AGM through Video Conferencing (VC)/other Audio Video Conferencing (OAVM) on 27th September, 2025 can cast their vote during the AGM electronically on the businesses specified in the notice of AGM through electronic voting system (E-Voting) of NSDL

In case shareholders/ investor have any queries regarding virtual meeting, you may refer the Frequently Asked Questions ("FAQs") available at https://www.evoting.nsdl.com/ under download section or you can email us to evoting@nsdl.com or call us at: -022 4886 7000 Book Closure: Pursuant to Section 91 of the Companies Act, 2013, the Register of Members & Share Transfer Books of the company will remain closed from Sunday, the 21st day of September, 2025 to Saturday, the 27th day of September, 2025 (both days inclusive) for the purpose of Annual General Meeting and to determine eligible Shareholders for the payment of Dividend, if declared at the AGM.

By Order of The Board For Kalana Ispat Limited Sd/-

Date: 01.09.2025 Place: Ahmedabad

Varghese Joseph Potterterly Managing Director DIN: 02771578

GHAR SURANSHIT - AAP SURANSHIT www.ultracab.in / cs@ultracab.in, CIN: L31300GJ2007PLC052394

**ULTRACAB (INDIA) LIMITED** 

ULTRACAB Regd. Office: Survey No. 262, B/h. Galaxy WIRES A CABLES Bearings Ltd., Shapar (Veraval) - 360024, Dist.: Rajkot, Gujarat, India.

NOTICE OF 18th ANNUAL GENERAL MEETING, E-VOTING AND CUT-OFF DATE NOTICE is hereby given that the 18th Annual General Meeting (AGM) of the

Members of the Company will be held on Friday, September 26, 2025, at 11:00 a.m., hrough Video Conferencing (VC) / Other Audio Visual Means (OAVM), without the physical presence of members at a common venue in compliance with General Circular No. 09/2024 dated September 19, 2024, read with earlier circulars issued by the Ministry of Corporate Affairs (collectively, "MCA Circulars") and SEBI Circular No. SEBI/HO/CFD/POD-2/PCIR/2024/133 Dated October 3, 2024, along with other applicable circulars issued by the Securities and Exchange Board of India (SEBI) which permit the holding of AGM through VC/OAVM, without the physical presence of nembers at common venue, to transact the Ordinary and Special businesses as set out

In compliance with the aforesaid circulars, the Company has completed dispatch of electronic copies of the Notice of the 18th AGM along with the Integrated Annual Report for the Financial Year (FY) 2024-25 on September 02, 2025, through electronic mode only, to those shareholders whose email addresses were registered with the Company / Depository Participants ("DPs") / Registrar and Transfer Agent ("RTA"), i.e., Bigshare Services Pvt. Ltd. Additionally, in accordance with Regulation 36(1)(b) of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations 2015 (the "Listing Regulations"), a Separate letter containing the Weblink to access the Integrated Annual Report is also being dispatched to those shareholders whose email ID are not registered with the Company/ DP/RTA.

The Notice and the Integrated Annual Report for FY 2024-25 are also available on the Company's website at www.ultracabwires.com and on the website of the Stock Exchange i.e. BSE Limited (www.bseindia.com) and on the NSDL's Website (www.evoting.nsdl.com). Members are requested to refer the Newspaper Advertisement Published on September 01, 2025, in the Financial Express (English Edition) and Financial Express (Gujarati Edition) for other details pertaining to the meeting.

E-voting Information: In accordance with the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules 2014, and amendments thereto and Regulation 44 of the Listing Regulations, the Company is pleased to provide its Members the facility to cast their votes electronically, through the remote e-voting services provided by National Securities Depository Ltd. (NSDL), on all resolution set forth in the Notice. The Company has sent e-mail through NSDL along with details of Login ID and Password to the Members whose e-mail ids were available with the Company or have been provided by the Depositories. The facility of electronic voting will also be made available during the AGM for those members who have not cast their votes by remote e-voting. The Board has appointed Mr. Piyush Jethva, Practicing Company Secretary as Scrutinizer for conducting the voting process in a fair and transparent manner. The member may note the following:

The Ordinary and Special Businesses as set out in the AGM Notice may be transacted through voting by electronic means.

Members holding shares as on the cut-off date i.e. Friday, September 19, 2025, may cast their votes electronically on businesses as set out in notice either through remote e-voting or e-voting during the AGM.

Any person, who acquires shares and become a member of the Company after sending the notice and holding shares as on the cut-off date i.e. Friday, September 19, 2025 May obtain the login id and password by sending an email to evoting@nsdl.com by mentioning his/her Folio Number/ DP ID and Client ID Number. However, if you are already registered with NSDL for e-voting then you can use your existing user ID and password for casting your vote.

The Remote e-voting period commences on Tuesday, September 23, 2025, at 09:00 a.m. and ends on Thursday, September 25, 2025, at 05:00 p.m. The remote evoting module shall be disabled by NSDL for voting thereafter. The remote e-voting shall not be allowed beyond the said date and time

The members who have already cast their votes by remote e-voting prior to the meeting may also attend the AGM through VC/OAVM, however, they shall not be entitled to vote again during the meeting. The detailed procedure for participating in the AGM and detailed instructions for remote e-voting and e-voting during the AGM are provided in the AGM Notice.

Email Registration for Non-Registered Members: Members who have not registered their email addresses with their Depository Participants and have therefore not received the Notice and Annual Report, are requested to send their email address to cs@ultracab.in by 5:00 p.m. on September 19, 2025. The email should include the following details for verification purposes: Full Name and DPID/Client ID.

Please Note: The email address registered via this communication will be used only for sending the Notice and Annual Report for FY 2024-25.

Helpdesk for Queries or Grievances: In case of any queries or grievances related to attending the AGM or e-voting, Members/Beneficial Owners may refer to the Frequently Asked Questions (FAQs) and user manual for e-voting available on the NSDL website at www.evoting.nsdl.com or may contact on Toll Free No. 022 -

Date: September 02, 2025 Place: Mumbai

dated October 3, 2024

By Order of the Board, ULTRACAB (INDIA) LIMITED. Sd/- Nitesh Parshottambhai Vaghasiya Chairman & Managing Director, DIN: 01899455

#### S D RETAIL LIMITED CIN: L52520GJ2004PLC056076

Regd. Office: C-929, Stratum at Venus Ground, Near Jhansi Ki Rani Statue, Nehru Nagar, Ahmedabad-380006, Gujarat, India | Contact: 7043106787 Email: sdrpl@sweetdreamsindia.com | Website: www.sweetdreams.in

NOTICE TO SHAREHOLDERS

1) Notice is hereby given that the 21st Annual General Meeting (AGM) of the Members of S D RETAIL LIMITED is scheduled to be held at 02.00 P.M., on Thursday, September 25, 2025 through Video Conferencing / Other Audio Visual Means (VC/OAVM), in compliance with the General Circular No.09/2024 dated 19.09.2024 read with Circular No.20/2020 dated 05.05.2020 issued by the Ministry of Company Affairs (MCA) and Circular No. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133 dated 03.10.2024 read with Master Circular No. SEBI/HO/CFD/PoD2/ CIR/P/0155 dated 11.11.2024 issued by the Securities and Exchange Board of India (SEBI) (hereinafter collectively referred to as 'Circulars') and also applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder,

(2) In compliance with the above Circulars, electronic copies of the Notice of the AGM and the Annual Report for the year 2024-25 have been sent to all the Members on September , 2025 whose Email IDs are registered with the Company/Registrar & Transfer Agent/Depository Participant(s). Further, in compliance with Regulation 36(1)(b) of SEBI (Listing Obligations & Disclosures Requirements) Regulations, 2015, physical letters containing the web link including exact path where complete details of the annual report are available is also dispatched to the shareholders whose email ids are not registered with the Company / Depository Participant("DPs")/ Company's Registrar. The Company shall send physical copy of the 21st Annual Report for FY 2024-25 to those Members who request for the same at cs@sweetdreamsindia.com.

However, Members can also download the Annual Report from the weblink i.e. https://cdn.shopify.com/s/files/1/0490/3331/4465/files/SDREAMS\_ANNUAL\_REPORT\_ 2024-25.pdf?v=1756115126, the Notice of AGM can be downloaded from the weblink .i.e. https://www.sweetdreams.in/pages/annual-general-meeting and from the website of Stock Exchange at www.nseindia.com and the same is also available on the website of NSDL i.e. at www.evoting.nsdl.com

(3) Pursuant to the provisions of Section 108 of the Act read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended and Regulation 44 of Listing Regulations, the Company is pleased to provide remote e-voting facility to the members before / during the AGM to cast their votes in respect of businesses as set forth in the Notice convening the 21st AGM. The Company has availed the services of National Securities Depository Limited ('NSDL') for facilitating the e-voting through electronic

(4) The Members holding shares, as on the cut-off date (i.e.) September 18, 2025, may cast their vote electronically on the businesses as set out in the Notice of the AGM through

electronic voting system of either through remote e-Voting or e-Voting during the AGM. (5) The Board of Directors have appointed M/s Monika Chechani & Associates, Practicing Company Secretary (Membership No. F9253 and CP No. 10883) as the Scrutinizer for conducting both the remote e-Voting and e-Voting during the AGM in a fair and transparent

(6) The Members are hereby informed that:

manner.

 (i) The businesses as set out in the Notice of the AGM may be transacted through remote e-Voting or e-Voting during the AGM.

(ii) The remote e-Voting shall commence at 9.00 a.m., on Monday, September 22, 2025. (iii) The remote e-Voting shall end at 5.00 p.m., on Wednesday, September 24, 2025.

(iv) The remote e-Voting module will be disabled after 5.00 p.m., on September 24, 2025. (v) The cut-off date for determining the eligibility to vote either through remote e-Voting or by e-Voting during the AGM is September 18, 2025.

(vi) The Members may note that:

(a) The remote e-Voting module shall be disabled after 5.00 p.m., on September 24, 2025 and once the votes on the resolution is cast by the Member, the Member shall not be allowed to change it subsequently. (b) The facility for voting will also be available during the AGM and those Members present

in the AGM through VC / OAVM facility, who have not cast their vote on the resolutions through remote e-Voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through the e-Voting during the AGM. (c) The Members who have cast their votes by remote e-Voting prior to the AGM may also

attend the AGM but shall not be entitled to cast their votes again; and (d) A person whose name is recorded in the Register of Members or in the Register of

Beneficial Owners maintained by the Depositories as on the cut-off date shall be entitled to avail the facility of remote e-Voting or e-Voting during the AGM. (vii) In case a person has become a Member of the Company after the Notice is being sent

but on or before the cut-off date for e-voting, i.e. September 18, 2025, may approach

NSDL at evoting@nsdl.com for issuance of the user id and password for exercising their

right to vote by electronic means. (viii) The manner of voting remotely for Members holding shares in dematerialized mode, physical mode and for Members who have not registered their e-Mail addresses is provided in the Notice of the AGM which is also available on the website of the Company at

(ix) In case of any query and/or grievance, in respect of e-voting, Members may refer to the Frequently Asked Questions ("FAQs") and e-voting user manual available at the download section of https://www.evoting.nsdl.com or call 022-4886 7000 or send a request to Ms. Pallavi Mhatre, Senior Manager at evoting@nsdi.com.

For S D RETAIL LIMITED

Date: 02.09.2025 Place: Ahmedabad

**POOJABEN SHAH** Company Secretary & Compliance Officer Membership No. A73158

## ward WARDWIZARD INNOVATIONS & MOBILITY LIMITED CIN: L35100MH1982PLC264042

Regd. Office: Office No 4604, 46th Floor Kohinoor Square, Kelkar Marg, Shivaji Park Dadar (West) Nr. R.G. Gadkari Chock Mumbai Maharashtra- 400028, India Corporate Office: Survey 26/2, Opposite Pooja Farm Sayajipura, Ajwa Road Vadodara-390019, Gujarat, India

Email: compliance@wardwizard.in | Website: www.wardwizard.in | Tel No: +91 6358849385 INFORMATION TO THE MEMBER REGARDING 43rd ANNUAL GENERAL

MEETING OF WARDWIZARD INNOVATIONS & MOBILITY LIMITED TO BE HELD THROUGH VIDEO CONFERENCING ("VC") / OTHER AUDIO VISUAL MEANS ("OAVM" Members of the Company may note that the Forty-third (43rd) Annual General Meeting "AGM") will be held on Tuesday, September 30, 2025 at 01:00 P.M. (IST) through VIDEO CONFERENCING ("VC") / OTHER AUDIO VISUAL MEANS ("OAVM"), in compliance with applicable provisions of The Companies Act, 2013 ("the Act") and the relevant Rules framed thereunder and under the Securities and Exchange Board of India ('SEBI') (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations"). as amended from time to time, read with latest General Circular No. 09/2024 dated September 19, 2024 and all other applicable circulars, if any, issued by the Ministry of Corporate Affairs ('MCA') from time to time and SEBI vide its Circular No. SEBI/HO/CFD/CFD-PoD2/P/CIR/2024/133 dated October 3, 2024 issued by SEBI hereinafter collectively referred to as "the Circulars") to transact the business set out in the Notice dated 01st September, 2025 ('the 'Notice') calling the 43rd AGM.

In compliance with the above circulars, electronic copies of the Notice of the 43rd AGM along with the Annual Report for the Financial Year 2024-2025, will be sent through electronic mode to those Members whose email addresses are registered with the Company/Depository Participant(s).

In compliance with Regulation 36 (1) (b) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended, we are required to provide the web-link, including the exact path, to the complete Annual Report to those members who have not egistered their email addresses with the Company or any Depository, or with the Registrar & Share Transfer Agent (RTA) of the Company.

Members may note that the Notice of the 43rd AGM and Annual Report 2024-25 will also be made available on the Company's website at https://wardwizard.in/, BSE Limited website at www.bseindia.com, and on the website of National Securities Depositories Limited., appointed for conducting Remote e-voting, e-voting during the process of AGM and VC at www.evoting.nsdl.com.

Members can attend and participate in the 43rd AGM of the Company through the VC/OAVM facility only. The Instructions for joining the AGM of the Company and manner of participation in remote e-voting or casting vote through the e-voting system during the meeting will be provided in the Notice convening of 43rd AGM. Member's participation in the AGM through VC/ OAVM facility shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

Members may cast their vote through Remote e-voting during the AGM through NSDL through "Electronic Voting platform". The Cut-off date for determining eligibility to cast the vote is Tuesday, September 23, 2025. The Remote E-Voting period will commence from Saturday, 27th September, 2025 at 09.00 A.M. to Monday, 29th September, 2025 at 05.00 M. (IST) Thereafter e-voting module shall be disabled by NSDL.

PROCESS FOR THOSE SHAREHOLDERS WHOSE EMAIL/MOBILE NO. ARE NOT REGISTERED WITH THE COMPANY/DEPOSITORIES.

For Physical shareholders- please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back). PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) pursuant to aforesaid SEBI Circulars in Form ISR-1 by email to support@purvashare.com.

For Demat shareholders - Please update your email id & mobile no. with your respective Depository Participant (DP)

For Individual Demat shareholders - Please update your email id & mobile no, with your respective Depository Participant (DP) with whom they maintain their demat accounts which is mandatory while e-Voting & joining virtual meetings through Depository. MANNER OF CASTING VOTE(S) THROUGH E-VOTING:

Members will have an opportunity to cast their votes on the businesses as set out in the

Notice of the 43rd AGM dated 01st September; 2025 through electronic voting system (e-

The manner of voting remotely (remote e-voting) by Members holding shares in dematerialized mode, physical mode and for members who have not registered their email addresses has been provided in the Notice of the 43rd AGM.

The facility of e-voting through electronic voting system will also be made available

during the AGM. Only those shareholders, who are present in the AGM through VC/OAVM facility and who have not cast their vote on the Resolutions through remote e-Voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-Voting system available during the AGM. Shareholders are requested to carefully read all the Notes set out in the notice of the 43rd

AGM dated 01st September, 2025 and in particular, instructions for joining the AGM, manner

of casting vote through remote e-voting or e-voting during the process of AGM.

Shareholders may please note that in terms of aforementioned circulars, the Company will not send physical copies of AGM Notice to the Shareholders. Shareholders will receive the AGM notice only through e-mail registered with the Company. By Order of the Board For Wardwizard Innovations & Mobility Limited

> Jaya Ashok Bhardwaj Date: 02.09.2025 Company Secretary and Compliance Officer Place: Ahmedabad

## RATNABHUMI DEVELOPERS LIMITED

CIN: L45200GJ2006PLC048776 Regd. Office: Ratna Corporate House, Near Santoor Bungalows, Ambli Daskroi,

Ahmedabad -380058, Gujarat, India | Tel No.: +91- 87585 51175; Email: compliance@ratnagroup.co.in; Website: www.ratnagroup.co.in; NOTICE OF NINETIETH ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

Notice is hereby given that the 19th Annual General Meeting (AGM) of the Members of the Company "Ratnabhumi Developers Limited" ("Company") (CIN: L45200GJ2006PLC048776) is scheduled to be held on Saturday, September 27, 2025 at 11:00 A.M. IST through Video Conferencing (VC)/Other Audio Visual Means (OAVM), to transact the businesses as set out in the Notice of AGM pursuant to the General Circular No.

09/2024 dated September 19, 2024, issued by the Ministry of Corporate Affairs (MCA) read

with circular issued by SEBI vide circular no. SEBI/HO/CFD/CFDPoD-2/P/CIR/2024/133

Notice of AGM and Annual Report for FY 2024-2025 is dispatch to all the eligible members whose e-mail address are registered with the Depository Participants (DPs) / Company Registrar & Transfer Agent of Company through electronic mode only and the physical copy of the AGM Notice and Annual Report will not be sent separately to any shareholder. Pursuant to Regulation 36(1)(b) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company has sent a letter providing a web-link of the Annual Report 2024-25 to those Members who have not registered their e-mail addresses with the Company/Depositories. The Annual Report is also available on the website of the Company at www.ratnagroup.co.in.

The businesses as mentioned in the Notice of AGM may be transacted through e-voting facility to enable the eligible members to cast their votes electronically and accordingly Company has engaged the services of NSDL to provide remote e-voting facility and e-voting facility during the AGM to the eligible members of the company. The Notice of AGM is published on the website of NSDL's at www.evoting.nsdl.com and on Company's website at

The members can participant in the Annual General Meeting ONLY through VC/OAVM facility. The details of which is provided by the company in the Notice of the Meeting. Accordingly, no provision had been made to enable the shareholders to attend and participate in the 19th AGM of the company in person. Members attending the AGM through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under section 103 of the Companies Act, 2013.

The details required under Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of Companies (Management and Administration) Rules, 2014, Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Secretarial Standard issued by ICSI, are mentioned below:

1. The Ordinary and Special Businesses as set out in the Notice of AGM may be transacted through voting by electronic means only, which is detailed in the Notice;

The cut-off date for determining the eligibility to vote by electronic means is Saturday.

The remote e-voting of the Company shall commence on Wednesday, September 24. 2025 from 09.00 A.M. IST and end on Friday, September 26, 2025 at 05.00 P.M IST. The remote e-voting shall not be allowed beyond the aforesaid date and time. Once the votes are cast by the members the same cannot be changed by them;

A person, whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the Depositories as on the cut-off date i.e. Saturday, September 20, 2025, shall only be entitled to avail facility of remote e-voting or e-voting at the AGM:

A person, who acquires the shares and becomes a shareholder of the company after the dispatch of the Annual Report and holds shares as on the cut-off date i.e. Saturday. September 20, 2025, may follow the procedure for obtaining User ID and Password as provided in the Notice of the Meeting which is available on the website of the company and on NSDL's website. If the Shareholder is already registered with NSDL for e-voting then he/she can use his/her existing user ID and Password for casting the vote through

6. The members who have cast their vote through remote e-voting prior to the AGM may also attend the AGM through VC and OAVM but shall not be entitled to cast their vote

The Company has appointed Ms. Insiya Nalawala, Practicing Company Secretary, as the Scrutinizer to scrutinize the e-voting process in a fair and transparent manner;

Members are requested to note that pursuant to the MCA and SEBI circulars, the company

will not be sending physical copies of AGM Notice and Annual Report to the members of the company. In case of any queries or issues regarding e-voting, members are advised to refer the "FAQ" and "E-Voting user manual" available at www.evoting.nsdl.com or write an email to

In case of any grievance connected with facility for voting by electronic means members may contact to Mr. Kaivan Shah, Managing Director of the Company, Contact Number: +91-8758551175, Email Id: compliance@ratnagroup.co.in, Registered Office Address: Ratna Corporate House, Near Santoor Bungalows, Ambli Daskroi, Ahmedabad - 380 058, Gujarat, India By order of the Board of Directors

For, Ratnabhumi Developers Limited

Kaivan Shah Managing Director DIN: 01887130

# <u>VISAMAN</u>

VISAMAN GLOBAL SALES LIMITED CIN: L24311GJ2019PLC108862 Regd. Office: C/O., Jain Traders, 8, Sorathia Wadi, Near Narmada, 80 Feet Road, Rajkot- 360002, Gujarat, India

Ph: 90237 30627 Email: visamansales@gmail.com • Website: visamanglobalsales.com

## NOTICE OF 6TH ANNUAL GENERAL MEETING AND BOOK CLOSURE

NOTICE is hereby given that 6th Annual General Meeting (AGM) of the Members Visaman Global Sales Limited (the Company) will be held on Friday, September 26, 2025 at 11.00 A.M. (IST) at Registered office of the Company situated at C/o., Jain Traders, 8, Sorathiawadi Near Narmada, 80 Feet Road. Rajkot-360002, Gujarat, India.

As per the MCA Circulars and SEBI Circulars, the Notice of Annual General Meeting along with Annual Report of the Year ended on 31st March, 2025 has been sent through electronic mode to the Members of the Company whose email addresses are registered with the Company/Depositories as on 29/08/2025. Further, a letter providing the web-link, including the exact path, where the Annual Report and the Notice of the AGM for the financial year 2024-25 is available is being sent to those members whose e-mail address is not registered with the Company / M/s. MUFG Intime India Private Limited, Company's Registrar and Transfer Agent/Depository Participant(s)/ Depositories. Notice is also available at the website of the Company visamanglobalsales.com and also available at the website of Stock exchange at www.nseindia.com.

As per Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended and Regulation 44 of the SEBI(LODR) Regulations, 2015 and Secretarial Standards on General Meetings("SS2") issued by Institute of Company Secretaries of India, members are provided with facility to cast their vote on all the resolutions set forth in the said Notice, using electronic voting system(e-voting) provided by Central Depository Services (India) Limited. The voting rights of the Members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on 19/09/2025 ("cut-off date"). The details as required pursuant to the provisions of the Companies Act, 2013 and Rules made there under are given

1. Central Depository Services (India) Limited (CDSL) has been engaged by the

impany to provide the facility of e-voting. Member whose name are recorded in Register of Members as maintained by the RTA/DP as on the cut-off date i.e. 19/09/2025 will be entitled to cast their votes by evoting. Any person who is a member of the Company on Cut-off date is eligible to attend and cast votes on all the resolutions set forth in the notice of Annual General Meeting, Other members shall treat the Notice as for information purpose only.

 Pursuant to Section 91 of the Comapanies Act, 2013 and applicable rule hereunder, the register of members and share transfer book for equity shares of the Company will remain closed from 20/09/2025 to 26/09/2025 both days Voting through e-voting will commence on 22/09/2025, Monday (09.00 A.M.)

and ends on 25/09/2025, Thursday (5.00 P.M.). Voting through e-voting shall not be allowed beyond 05:00 P.M on 25/09/2025. 5. (i) Once the e-vote on the resolution is cast by the members, they shall not be allowed to change it subsequently (ii) the facility for voting through ballot paper shall be made available at the AGM for the members who have not cast their vote by remote e-voting A member may participate in the general meeting even after.

exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote

again in the meeting. 6. For e-voting instructions, members may go through the instructions in the Notice and in case of any queries or issues regarding e-voting, members may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com, under help section or write an e-mail to helpdesk.evoting@cdslindia.com or contact at 18002109911.

. Members who have not received Notice may contact RTA MUFG Intime India Private Limited by e-mail at rnt.helpdesk@linkintime.co.in or call 1800 1020

In case of any Queries, member can contact Company by sending Email at cs@visamansales.com By Order of the Board of Director

> Mitulkumar Sureshchandra Vasa Managing Director

> > DIN: 07789750

For Visaman Global Sales Limited

Ahmedabad

Place : Rajkot

Date: 03/09/2025

epaper.financialexpress.com

## આવાસ ફાયનાન્સિયર્સ લીમીટેડ

(CIN :L65922RJ2011PL C034297) ૨જી. અને કોર્યો. ઓફ્રીસ : ૨૦૧–૨૦૨, બીજો માળ,

સાંક્રિય એન્ડ સ્ક્લેર, માનસરોવર ઇન્ડસ્ટ્રીયલ એરિયા, જયપુર-૩૦૨૦૨૦



કબજા નોટીસ જત જણાવવાનું કે નીચે સહી કરનાર **આવાસ ફાચનાન્સિયર્સ લીમીટેડ** ના અધિકૃત અધિકારીએ સિક્યોરિટાઇ ઝેશન અને રિકન્ટ્રક્શ એસેટઅને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટીઇન્ટરેસ્ટએક્ટ,૨૦૦૨ હેછા અને સિક્યોરીટીઇન્ટરેસ્ટ(એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમલ્સાથે વયાર્ત કલમ ૧૩/ ૧૨) હેલા. મને માલેલ સત્તાનો ઉપયોગ કરીને જણાવેલ નોટીસની બજવણીની તારીખથી દ૦ દિવસની સંદર સબંદિલ નોટીસમાં નીચે જણાવ ૨૬મ ચુકવી જવા દેવાદારોને માંગણાં નોટીસ પાઠવી હતી. દેવાદારો ૨૬મની પરત ચુકવણી કરવામાં નિષ્ફળ જતાં જણાવેલ નિયમોના નિયમ ૯ સાથે વંચાર્ત જણાવેલ કાયદાની કલમ ૧૩(૪) હેઠળ મળેલી સત્તાની રૂઝે નીચે જણાવેલે મિલકતોનો કબજો નીચે જણાવેલ તારીખોએ લઇ લીધો છે. ખાસ કરીને દેવાદારે અને જામીનદારોને અને જાહેર જનતાને અહીં સાવધ કરવામાં આવે છે કે મિલકતો સાથે કોઇ વ્યવહાર કરવો નહીં અને મિલકત સાથેનો કોઇ પણ વ્યવહાર **આવાસ ફાયનાન્સિયર્સ લીમીટેડ** ના અહી નીચે જણાવેલ ૨૬મ અને તેના પરનાં ચડત વ્યાજને આધિન રહેશે.

દેવાદાર નું નામ	માંગણા નોટીસની તારીખ અને રક્રમ	મિલકતની વિગત	કળજા નોટીસની નારીખઅને મુકદ 3૧-૦૮-૨૫ નાં ટોજ ભૌતિક કળજો લીંધો	
રુપેશ શિંદે, સૈફાલી શિંદે (એકાઉન્ટનં.)LNSUR0811- 230245078	૦૮–૦૨–૨૫ રૂા. ૫૯૭૨૯૮/– ૦૩–૦૨–૨૫ મુજબ	ક્લેટ/હાઉસ નં. ૪૮/૫૮૩, કાઠોદ્રા, કોલોની, ળ્લોક નં. ૪૬, ૪૭, ૪૮ અને એએમપી-૪૯, મોજે–ગામ–કાઠોદ્રા, સુરત, ગુજરાત. <b>ક્ષેત્રફળ ૨૮.૭૨ ચો.મી</b> .		
પરસોત્તમભાઇ દિતાભાઇ કામોર, ડામોર રતનાબેન પરસોત્તમભાઇ, ડામોર અનિલકુમાર પરસોત્તમભાઇ (એકાઉન્ટનં.)LNGDM17523- 240333407	૧૨–૦૫–૨૫ રૂા. ૧૧૪૨૬૩૯/– ૦૮–૦૫–૨૫ મુજળ	પ્લોટ નં. ૭૦, રેવન્થુ સર્વે નં. ૭૩૬, મારુતી નગર, ગામ–વર્ષામેડી, તાલુકો–અંજાર, જિદ્યો–કચ્છ, ગુજરાત. ક્ષેત્રફળ ૭૫.૪૦ થો.મી.	૩૧-૦૮-૨૫ નાં રોજ ભૌત્તિક કબજો લીધો	



#### ફોનિક્સ એઆરસી પ્રાઇવેટ લીમીટેડ રજીરહર્ડ એફ્રિસ : શ્રીજે માળ, વોલેસ ટાવર (અગાઉ શિવ બિર્લ્ડો ગ તરીકે જાણીતી), ૧૩૯/૧૪૦/બી/૧, શહર રોડ ક્રોસિંગ અને વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇવે, વીલે પર્લે (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૫૭

ક્ખાજા નોટીસ

માર્ટી ફોનિક્સ એઆરસી પ્રાપ્ટ વેઢ વીમીઢેડ (ફોનિક્સ ટ્રસ્ટ નાણાંકીય વર્ષ ૨૧-૬ નાં ટ્રસ્ટી તરીકે કાર્યરત) (ફોનિક્સ) ના નીચે ટાહી કરનાર અદિાકૃત અદિાકારીઝ રિક્યોરીટાઇ ઝેશન અને રીકન્ટરૂક્શન ઓફ ફાયનાન્સિયલ એરોટ્સ અને એન્ફોરમિન્ટ ઓફ રિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ અને રિક્યોરીટી ઇન્ટરેસ્ટ (ઝોન્ફોરમિન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૩ સાથે વંચાની કલમ૧૩( ૨) હેઠળ પ્રણ સત્તાનો ઉપયોગ કરીને નીચે જ્યાવેલ દેવાદારો, સહ-દેવાદારો, જામીનદારોને માંગણ . નોઢીરા જારી કરીને દેવાદારો, રાહ દેવાદારો અને જમીનદારોને આ નોઢીરામાં દર્શાવેલ રક્મ નોઢીરા મળ્યાનીતારીખથી ફ0 દિવરાની અંદર ચુકવવા જણાવ્યું હતું. જણાવેલ દેવાદારો, રાહ દેવાદારો, જામીનદારો રક્મની પરત ચુકવણી કરવામાં નિષ્ફળ હોવાથી દેવાદારો, રાહ દેવાદારો, જામીનદારો અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે નીચે રાઠી કરનારે જ્ણાવેલ નિયમોના નિયમ ટે સાથે વંચાતા જ્ણાવેલ ક્યાદાની કલ્ભ ૧૩(૪) હેઠળ તેમને પ્રાપ્ત રાતાનો ઉપયોગ કરીને નીચે જ્ણાવેલ મિલક્તનો કળજો રાહીં નીચે જણાવેલ તારીખોએ લઇ લીધો છે. ખાસ કરીને દેવાદારો, સહ દેવાદારો અને જામીનદારો અને જાહેર જનતાને આથી મિલકતો સાથે સોદો ન કરવા સાવદ કરવામાં આવે છે અને મિલકતો સાથેનો કોઇપણ સોદો મેસર્સ ફોનિક્સની જણાવેલ રકમ તેમજલાગતી વળગતી તારીખોથી તેના પરના ચડત વ્યાજ, કોરટ અને ચાર્જને

દેવાદારો, સહ-દેવાદારો, જમીનદારો, ગીરો મિલક્તની વિગત, દુરઠનું નામ, કલ્મ૧૩(૨) હેઠળ મોક્લેલમાંગણ નોટીરાઝાને તે હેઠળ દાવો કરાયેલ રક્યોની વિગત નીચે મુજબ છે

દેવાદાર, સહ-દેવાદારનું નામ અને સરનામું, લોન એકાઉન્ટ નંબર, લોનની રકમ	સિક્ચોરિટીની વિગતો	૧. માંગણા ગોટીસની તારીખ ૨. સાંકેલિક/ભૌત્તિક કબજાની તારીખ ૩. બાકીરકમ રૂા. માં
સાની લાવુભાઇ રાઠોક (S/D/W લાવુભાઇ રાઠોક) ૮-૯ દત્તકૃપા રોોરાણટી, સર્વોદય સોસાયટી પાસે, ઝામરોલી, સુરત, ગુજરાત-૩૮૪૧૦૭ હિમી સાની રાઠોક (S/D/W સાની રાઠોક) ૮-૯ દત્તકૃપા રોોસાયટી, સર્વોદય રોસાયટી પાસે, ઝામરોલી, સુરત, ગુજરાત-૩૯૪૧૦૭ લોન એકાઉન્ટ નંબર : LXSUR00215-160021850 મંજુર થયેલ લોનની રહમ : રૂા. ૭૩૨૨૦૫ (રૂપિયા સાત લાખ બગીસ હજર બસ્સો પાંચ પુરા)	૨૫૦-બી, ગ્રીન ઝોવન્યુ, ઉદિયાદ્દા, ઝાંક્લેશ્કાર, સુરત, ગુજરાત-૩૯૪૧૧૦ ખાતેની ગીરો	ર) ભૌતિક કબજાની તારીખ : 3૧.૦૮.૨૦૨ 3) રૂા. ૧૦૦૦૩૪૯/– ( રૂપિયા દસ વાખ ત્રણ ઓગણપચ્ચાણ પુરા) ૨૩.૦૮.૨૦૨૧ ની બા અને ચૂકવવાપાત્ર ૨૪.૦૮.૨૦૨૧ થી લાગ્
શ્થળ : સુરત તારીખ : ૦૩.૦૯.૨૦૨૫		અધિકૃત અધિકૃત અધિકૃત અધિકૃત અધિક ફોનિક્સ એઆર સીપ્રાઇવેટ વીમીટેડ વ

ફોનિક્સ એઆર સી પ્રાઇવેટ વીમીટેડ વતી (ફોનિક્સ ટ્રસ્ટ નાણાંકીય વર્ષ ૨૧-૬ નાં ટ્રસ્ટી)

## ઇન્ડસઇન્ડ બેંક લીમીટેડ

રજીસ્ટર્ડ ઓફીસ : ૨૪૦૧, જેન. શિમ્માયા રોડ,(કેન્ટોનમેન્ટ), પુને- ૪૧૧ ૦૦૧

**हका युभर क्राप्ट नान्स डिवीजन** : न्यु नं. ३४, जु.कोन. बेही रोड, टी.नगर, बेश्लघ - ६०००९७ **સ્ટેટ ઓફીસ** : ઇન્ડરાઇન્ડ બેંક, ગીજો માળા, બિઝનેરા ઇમ્પીરીયા-૫, ૧/૫, જાનાય પ્લોટ કોર્નર, ચાફિક રોડ, **આ**રકેરી કોલેજરામે, રાજકોટ, ગુજરાત-૩ દ્૦૦૦૧

# માં ગાણા નોહિસ પાકેસ કરાયાના કરાયાના મુખ્ય ને અને વાલ્યાના કરાયાના કરાયાના સામ સ્પાન કૃષ્યને કૃષ્યને કૃષ્યને ક માં ગાણા નોહિસ મુક્કા મહાને મુક્કા માર્ચના જ્યારેલ એસ્ટ્સ એન્ડ એન્ફ્સ્રેસેમન્ટ ઓફ સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ ની કલમ ૧૩(૨) હેઠળ જારી કરાયેલ નોહીસ) આથી નોહીસ ગાપવામાં આવે છે કે નીચે જ્યાવેલ દેવાદારો∳જામીનદારોએ બેન્ક પારોથી લીઘેલી નીચે જ્યાવેલ હિરાણ સવલતોની પુનઃચૂક્વણીમાં ક્સુર કર્યો છે અને

ઉપરોક્ત સવલતોને બેન્કદ્વારા નોન પરફોમિંગ ઝેરોટ્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. જેમાં સરફૈસી ઝોક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩(૨) હેઠળ રજિસ્ટર પોસ્ટ દ્વારા તેમ ) દ્યા જાણીતા સરનામે નોટીસ જારી કરવામાં આવી હતી તે બજવણી વિના પરત ફરી છે અને આ બાબતે જાહેર નોટીસ દ્વારા જાણ કરવામાં આવે છે નોટીસની વૈકલ્પીકળજ્વણીના પગલા લેવાઇ રહ્યાં છે. ઉપરોક્ત દેવાદાર, સહ-દેવાદારો અને/અથવા તેમના જામીનદાર( લાગુ હોય ત્યાં) ને આ નોટીસ પ્રસિદ્ધ થયાની તારીખથી ૬૦ દિવસની ઝાંદર બાકી સ્કમની ચુકવણીઓ કરવા સલાહ આપવામાં આવે છે, જેમાં નિષ્ફળ જતાં સિક્યોરીટાઇપ્રેશન અને રીકન્સ્ટૂક્શન ઓર્ કાયનાન્સિયલ ઝોરોટ્સ અને ઝોન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ની જોગવાઇઓ મુજળ અન્ય પગલા લેવામાં આવશે. એક્ટની કલ્મ ૧૩ ની પેટા ક્લમ (૧૩) ની જોગવાઇઓ પ્રત્યે દેવાદાર નું ધ્યાન દોરવામાં આવે છે, જે હેઠળ દેવાદારો બેંકની આગોતરી લેખીત મંજૂરી વગર સિક્યોર્ડ મિલક્તોની વેચાણ, ભાડે અથ અન્ય રીતે તળદીલી કરવા હકદાર નથી.

<del>ક</del> મ નં.	લોન અંકાઉન્ટ નબર, લોનના રકમ, દેવાદાર/સહ–દેવાદાર/ જામીનદારનું નામ/ માંગણા નોટીસની તારીખ / બાકી રકમ	સિક્યોર્ડ એસેટ્સ/મિલકતની વિગત		
L	લાકારકાર કા. દૂ, ૧૬,૧૫૩.૭૫/- ૩૦/૦૧/૧૦૫૧ મુખ્ય તેમ કરાળા પરનુ લેક્સ વ્હાપ્ત દેવાદાર : શ્રી જી. હિંમતગીરી જે વેલગીરના પુત્ર	ક્ચ્છ, સળ રજીસ્ટ્રેશન જિલો-માંડવી, રજીસ્ટ્રેશન જિલો-ક્ચ્ય રાજ્ય-રાજ્યન ભાવેની વિવક્તના		

૪૫, સ્વામીનારાચણ નગર, શાળા વાળી શેરી જુનાવાસ, માધાપુર–3000**૨**૦ 👤 લોન એગ્રીમેન્ટ નં. GJG05026M પ્લોટ નં. ૩૩૮/૪૧, 'શ્રીજી પાર્ક' તરીકે જાણીતો એરિયા, રેવન્યુ સર્વે નં લોનની રહ્નમ : રૂા. ૬૦૯૨૬૩/– માં ઝણા નોટીસની તારીખ : ૨૯ .૦૯ .૨૦૨૧ ૩૨૭/પૈકી-૧, ક્ષેત્રફળ આશરે ૫૬-૫૧ ચો.મી., મુકામ–ગામ–કોડા **ખાકી રકમ : રૂા. દ્રશ્યરલ /- ૧૦.૦૯.૨૦૨૧ મુજબ તેમજ તેના પરનું** તાલુકો-માંડવી, જિલો-કચ્છ, સળ-૨જીસ્ટ્રેશન જિલો-માંડવી, રજીસ્ટ્રેશન **ચકત વ્યાજ દેવાદાર : શ્રી/શ્રીમતી નિતિનભારથી ગોરવામી** S/D/w/o **પ્રેમભારથી** જિલો–ક્ચ્છ, રાજ્ય–ગુજરાત ખાતેની જમીન અને બિલ્કીંગના તમામ શક્તિ નગર, માંડવી, ગઢિસા રોડ, કચ્છ, ગુજરાત, પીન-૩૭૦૪૪૫, ફોન:૯૯૭૯૬૨૦૧૯૪ **અહીં પણ** : હાઉસનો મુકામ-પ્લોટનં. ૩૩૮૪૧, શ્રીજી પાર્ક, એપ્રોચીંગ થી માંડવી, કચ્છ, પીન-૩૭૦૪૬૫, ફોન : નં. ૩૨૭ પૈકી, ઉત્તર : પ્લોટ નં. ૩૩૮/૪૨, દક્ષિણ : પ્લોટ નં. ૩૩૮/૪૦

👢 લોન એગ્રીમેન્ટ નં. GAY05030 M & GAY05031M લોનની રહમ : રૂા. ૧૧,૯૩,૧૧૬.૫*૭|-*માં ઝણા નોઢીસની તારીખ :૧૦.૦૨.૨૦૨૦

પહેલો માળા, ક્લેટ નં. એચ–૧૦૨, ક્ષેત્રકળ આશરે ૬૯.૬૦ ચો.મી. સુપર બિલ્ટ અપ એરિચા તેમજજમીન

અને કોમન સગવડોનો ન વહેંચાયેલ હિસ્સો, 'દેવ

કૃપા–૨' તરીકે જાણીતી સ્કીમ, તેમજ ળિન– ખેતીલાચક જમીનનો ટીપી સ્કીમ નં. ૧૧૦, એફ.પી.

નં. ૨૮ (સર્વે નં. ૪૦૩) મુકામ-મોજે-ગામ-નિકોલ,

અસારવા,તાલુકો–રજીસ્ટ્રેશન જિલો અને પેટા જિલો

અમદાવાદ–૧૨ ( નિકોલ ) ખાતેની મિલક્તના તમામ

ભાગ અને હિસ્સા. **ચતુ:સીમા** : ઉત્તર : ફ્લેટ નં

એચ/૧૦૨, દક્ષિણ : માર્જીન જમીન અને ખુદ્યો પ્લોટ

પૂર્વ : પેરોજઅને ફ્લેટ નં. એ/૧૦૩, પશ્ચિમ : બ્લોક જ

પહોળો રોડ

સળ પ્લોટ નં. ૧૦૪/૯ , આદિત્ય પાર્ક સભ પ્લાટ ન ૧ જકુદ, સમાદન્ય પાક, દિલાયન્સ પેટ્રોલ પંપ પાછળ, રાજપાર્ક પાસે, રાજકોટ, વિભાપુર, ક્ષેત્રફળ પ્લોટ એરિયા ૬૯.૬૬ સો.મી., તેમજ ળાંધકામનો સિટી સર્વે નં.

૧૪૭/૧૦૪/૯, શિટ નં. ૧૯૨/૧૯૯,

વોર્ડ નં. ૧૧ ખાતેની જમીનનાં તમામ

ભાગ અને હિસ્સા. **ચતુ:સીમા** : ઉત્તર

: સળપ્લોટ નં. ૧૦૪/૮, દક્ષિણ : સળ

પ્લોટ નં. ૧૦૪/૧૦, પુર્વ : રેવન્યુ સર્વે

નં. ૫૩ ની જમીન, ૭.૫૦ મીટરનો

જિદ્યો–મોરળી, મુકામ–મોરળી તાલુકો–ગામ-

મહેન્દ્રનગર રેવન્યુ સર્વે નં. ૭૭ પૈકી૧, રાજધિર પેલેસ–એ તરીકે જાણીતી રેસિડેન્સીયલ

બિલ્કીંગ,પાંચમો માળ,ફ્લેટનં. ૫૦૩,બિલ્ટઅપ

એરિચા ૭૫–૬૭ ચો.મી.,બાલ્કનીએરિચા ૧–૪૬

ચો.મી., કલ બિલ્ટ અપ એરિયા ૭૭-૧૩ ચો.મી

ટેરેસના હક્ક વગર), જિલો–મોરળી, ખાતેર્ન

મિલક્તના તમામ ભાગ અને હિસ્સા. **ચતુ:સીમા** : ઉત્તર : ફોચર, સીડીઓ અને લિફ્ટ અને ફ્લેટ

નં. ૫૦૪, મુખ્ય દરવાજો, દક્ષિણ : કોમન પ્લોટ

નં. ૮, પુર્વ : ફ્લેટ નં. ૫૦૨, પશ્ચિમ : ઓટીએસ

ખુલી જમીન, 'રાજધિર પેલેસ–એ' અને રાજધિર

પેલેસ–ળી, રાજધિર પેલેસ–ળી, પ્લોટ નં. ૧૧

જિલો–મોરળી, મુકામ–હળવદ, તાલુકો–ગામ– ચારવાડા રેવન્થુ સર્વે નં. ૯૦૨, સર્વે નં. ૯૦૩, સર્વે નં

૮૯૪/૨, સર્વે નં. ૮૯૪/૩, સર્વે નં. ૯૯૬ , એન.એ. પ્લોટ

આપ એરિચા ૪૬–૫૪ ચો.મી. અને પહેલો માળ, બિલ્ટ અપ એરિચા ૩૧૦૮૯ ચો.મી., કુલ બિલ્ટ અપ એરિચા ૭૮–૪૩ ચો.મી., બિલો–મોરળી ખાતેની મિલક્તના

તમામ ભાગ અને હિસ્સા. **ચતુ:સીમા** :પુર્વ : એન.એ

ટોડ, પશ્ચિમ : એન.એ. રોડ, ઉત્તર : પ્લોટ નં. ૨૧,

દક્ષિણ : પ્લોટ નં. ૧૯ ની જમીન

i. ૨૦, જમીનનો ક્ષેત્રફળ ૨૧૩–૪૦ ચો.મી., બિલ્ટ

ખાકી રક્સ : રૂ1.૧૬, 30, ર૧૪. 30/-૧૦.૦૨.૨૦૨૦ મુજબ તેમજતેના પરનું થકત વ્યા૧ દેવાદાર : પહેલ ક્રેતન સોમાભાઇ પહેલ, દવાદર : પરલ કતન સામામા પરલ, એચ/૧૦૨, દેવ. કૃપા-૨, સંદગુરુ હોમ્સ પાસે, નિકોલ, અમદાવાદ, ગુજરાત-૩૮૨૩૫૦ **અહીં પણ** :એસ-૧૦૨, પહેલો માળ, દેવકૃપા ૨, સર્વે નં. ૪૦૩, નિકોલ, અસારવા, તાલુકો, અમદાવાદ-3૮૨૩૫૦.

ત્રહ-દેવાદાર(રો) : પટેલ કર્વિષભાઇ સોમાભાઇ, એચ/૧૦૨, દેવ કુપા-૨, સદગુરુ હોમ્સ પાસે, નિકોલ, અમદાવાદ, ગુજરાત-૩૮૨૩૫૦ સ**૯-દેવાદાર(૨)) : જ્યોત્સનાબેન સોમાભાઇ પટેલ** 

એચ/૧૦૨, દેવ કૃપા–૨, સદગુરુ હોમ્સ પાસે, નિકોલ, અમદાવાદ, ગુજરાત–૩૮૨૩૫૦

👢 લોન એ ગ્રીમેન્ટ નં. GJJ05125M લોનની રહમ : રૂા.૧૫,૧૦,૦૦૦/-ાંગણા નોટીસની તારીખ : ૧૯.૧૨.૨૦૨૪ ખાકી રક્રમ : રૂં!. ૧૭,૯૧,૬૦૭.૧૮/– ૧૯.૧૨.૨૦૨૪ મુજબ તેમજ તેના પરનું ચકત વ્યાજ દેવાદાર :શ્રી સમીર શ્રેણીક જે તારિફભાઇ શેખના પુત્ર,

સિદ્ધેશ્વરી સોસાચટી, એસટીઆર નં. ૩, નવાગામ ઘેડ, જામનગર, ગુજરાત-૩૬૧૦૦૮, મોળાઇલ-૭૮૦૭૯૮૬૩૯ **અહીં પણ** : ભારમલ એલ્ચુમીનિચમ સ્ટેશન, સિદ્ધેશ્વર સોસાચટી, નવાગામ દોડ જામનગર, મોળાઇલ– ૮૭૮૦૭૯૮૬૩૯ **અહીં પણ** : પ્લોટ નં. ૧૦૪/૯, સર્વે નં. ૨૧૪*૭*/૧૦૪/૯, આદિત્ય પાર્ક, રાજપાર્ક પાસે .વિભાગર , જેએમએલ તાલકો-જામનગર , જિલો-ગજરાત-3દ૧૦૦૮ સ**૯-દેવાદાર(રો) : શ્રીમતી નુરઝાંહ શેખ સી/ઓ ગુલામ હુસૈન,** સિદ્ધેશ્ઘરી સોસાચટી, એસટીઆર નં , નવાગામ દોક, જામનગર,ગુજરાત–૩૬૧૦૦૮, મોળાઇલ–૮૭૮૦૭૯૮૬૩૯ જામનગર સિટી, જ્મીનનો રેવન્યુ સર્વે નં. ૧૦૯૬

लोन ओ.जीओन्ट नं, G.I.J05201M

लोननी २६म : ३१. १४,४०,०००/ui)अथा नोहीसनी तारीण : १.६.१२.२०२४

બાહી રહમ : રૂ1. ૧૫,૩૧,૩૪૭ .૨૦/- ૧૯.૧૨.૨૦૨૪ મુજબ તેમજ તેના પરનું ચકત વ્યાવ દેવાદાર : શ્રી મોદાવિયા રતનભાઇ જે અરમુ ગભાઇના પૂત્ર, બ્લોક નં. ૧૦, હાઉસિંગ બોર્ડ, યુ હર્ષદ મીલ, ચાલી, જામનગર–૩૬૧૦૦૫, મોળાઇલ : ૯૯૭૮૮૭૮૭૩૯ અહીં પણ :ક્લેટ નં. ૨૦૬,રિદિદ્ર એપાર્ટમેન્ટ, વિંગ-સી, સર્વે નં. ૧૦૯૬, મુરલીદાર ડેરીપાસે,

જામનગર સિટી, જ્મીનનો દેવન્યુ સર્વે નં. ૧૦૯૬ પૈકી, ક્ષેગફળ ૩૮૮૫૦.૦૦ ચો.મી., ફ્લેટ નં. ૨૦૬, બીજો માળ, રિદ્ધિ-ની એપાર્ટમેશ્ટ, પ્લોટ નં. ૧૧૬(૩, ક્ષેગફળ પ્લોટ એરિશ ૧૭૦.૮૮ ચો.મી., બિલ્ટ અપ એરિશા ૬૮.૨૧૬ ચો.મી. અને સુપર બિલ્ટ અપ એરિશા ૬૩.૨૮૭ ચો.મી., મુરલીદાર કેરી પાસે, ૨૯૫જીના ૧૦૧૦ કેર્ડ, આર્થિલાદ દિપ-૪, આર્થિલાદ દિપ, જેએમએલ તાલુકો, જેએમએલ જિલો, જામનગર, ગુજરાત-૩૬૧૦૦૫ ખાતેની જમીનનાં તમામ ભાગ અને હિસ્સા. **યનુ:સીમા**: ઉત્તર : ફ્લેટ નં. ૨૦૫, દક્ષિણ: પ્લોટ નં. ૧૨૦, પૂર્વ ! પ્લોટ નં. ૮૮,૬૯,૧૦૦ અને ૧૦૧, પશ્ચિમ: ૭.૫૦ મીટરનો પહેળો રોડ રણજીત સાગર રોડ પડખે, આર્શિવાદ દિપ–૪, જેએમએલ તા<del>કુ</del>લ, જેએમએલ જિલો 909 3E - 3E9 004 સહ-દેવાદાર(રો) : શ્રીમતી મોદાવિયા માલ્તી જે શ્રી રતનભાઇના પત્ની, બ્લોક નં. ૧૦, હાઉસિંગ ળોર્ડ, ન્યુ હર્ષદ મીલ, ચાલી, જામનગર–૩૬૧૦૦૫, મોળાઇલ : ૯૯૭૮૮૭૮૭૩૯

लोन से भीभेन्ट नं. GRM05226M લોનની રહમ : રા. ૧૩,૬૦,૦૦૦/-

ાંગણા નોટીસની તારીખ : ૧૯.૧૨.૨૦૨૪

ખાકી રકમ : રૂ1. ૧૩,૪૦,૪૨૫.૦૬/- ૧૯.૧૨.૨૦૨૪ મુજબ તેમજ તેના પરનું ચકત વ્યાવ **દેવાદાર : શ્રી વિમલકુમાર રામજીભાઇ કુનાપરા જે રામજીભાઇના પુત્ર, કે**શવ નગર, જીવાપર, યાકમપર, મોરળી-૩૬૩૬૪૧, મોળાઇલ : લ્હરહ૩૩૮૯૦૭ **અહીં પણ** : ઇનવેર સિરામીક્સ એલએલએપી, શક્તિ ચેમ્બર-૨ ૮-એ નેશનલ હાઇલે, મોરબી-૩૬૩૬૪૧, મોબાઇલ C-0 2-0 3 3 C C O 0

સહ-દેવાદાર( રો) : શ્રીમતી હનપરા ભાવનાખેન રામજભાઇ જે રામજભાઇના પત્ની, કેશ નગર, જુવાપર, ચાક્રમપર, મોરળી-3૬૩૬૪૧, મોળાઇલ : ૯૭૨૭૩૩૮૯૦૭ **અહીં પણ** : ફ્લેટ નં. ૫૦૩, વિંગ-એ, રાજધિર પેલેસ, હરીગન બિઝનેસ સેન્ટર પાછળ, મોરબી પીપળી રોડ ા હેન્દ્રનગર ચોક્ડી પાસે , હરીગન રેસિડેન્સી, મોરળી, પીનકોડ– ૩૬૩૬૪૨

📘 લોન એગ્રીમેન્ટ નં. GRR05560M લોનની રફમ : 31. ૧૧. ૩૫. ૦૦૦/-

માં ગણા નોટીસની તારીખ : ૨૮.૦૩.૨૦૨૫

ખાકી રક્રમ : રૂ1. ૧૨,૨૯,૮૮૧.૧૭/–૧૭.૦૩.૨૦૨૧ મુજબ તેમજ તેના પર નું ચકત વ્યાજ દેવાદાર : શ્રી નાસિર યુનુસભાઇ મુલતાણી વાચ વાચ જે યુનુસભાઇના પુંગ, ભગતનો લોટ ચરાડવા, સુરેન્દ્રનગર,ગુજરાત-3૬૩૩૩૦**ઝાહીં પણ** :પ્લોટ નં. ૨૦, ભગત પ્લોટ, મરવાડ વાડી શેરી, ચરાડવા, તાલુકો–હળવદ, સુરેન્દ્રનગર, જિલો–૩૬૩૩૩૦ સહ-દેવાદાર(૨ો) :શ્રીમતી મુલતાણી ફરિદાબેન યુનુસભાઇ જેશ્રી યુનુસભાઇના પદ્મી, મગતનો પ્લોટ ચરાડવા , સુરેન્દ્રનગર , ગુજરાત–3૬3330

🛔 લોન એગ્રીમેન્ટ નં. GSG05017M લોનની રક્ષ્મ : રૂા. ૧૦,૩૦,૦૦૦/–

ાંકલેશ્વર, જિલો–ભરૂચ–૩૯૩૦૦૧

તારીખ: 03.06.૨૦૨૫

ક્શાળ: ગુજરાત

માંગણા નોટીસની તારીખ :૧૪.૧૦.૨૦૨૪ બાહીરહમ :રૂl.૧૦,૨૦,૮૬૨.૯૪/− ૦૯.૧૦.૨૦૨૪ મુજબ તેમજ તેના પર નું ચકત વ્યાજ **દેવાદાર : શ્રી રગ્યી તિવારી જેશ્રી ધરમરાજના પુત્ર,** ૫૧, ઋષી નગર-૧ , મહારાણા પ્રતા ચોક પાસે,ગોડાદરા.સરત.પીનકોડ-૩૯૫૦૧૦

સહ-દેવાદાસ(૨)) : શ્રીમતી અશ્વિની તિવારી જે શ્રી રૂગ્યી તિવારીના પત્ની, ૫૧, ૠહ નગર-૧, મહારાણા પ્રતાપ ચોક પાસે,ગોડાદરા, સુરત, પીનકોડ-૩૯૫૦૧૦

👢 લોન એગ્રીમેન્ટ નં. GVV05014M डोननी २६म : ३१. १०,८६,०००/-માંગણા નોટીસની તારીખ : ૨૭.૧ ૨.૨૦૨૪ ખાકી રક્રમ : રૂI. ૧૪,૦૨,૮૦૬.૧૭/- ૨૩.૧૨.૨૦૨૪ મુજબ તેમજ તેના પરનું ચકત વ્યા **દેવાદાર : શ્રી ઇફતેખાર ચંદમો હમંદ જે ખરકાપ નના પુત્ર,** શિવાજી ચોક્ર હિંગળાજનગર, વિજાપોર નવસારી, મોળાઇલ – ૭૮૭૪૨૧૫૩૮૯ **અહીં પણ** : રેવન્યુ સર્વે નં. ૫૮૮, ૫૭૭ હાઉસ નં. ૪ળી/૩, ગ્રીનવેલી સોસાચટી, ડ્રિમસિટી સોસાચટી પાસે, દાંધલ, અંકલેશ્વર, જિલો–ભરૂચ–૩૯૩૦૦૧ સહ-દેવાદાર(૨)) શ્રીમતી અસરાફન નિશા અંસારી જે ઇફ્રતેખાર ચંદગોહમંદના પત્ની, શિવાજી ચોક હિંગળાજ નગર, વિજાપોર, નવસારી, મોળાઇલ – ૭૮૭૪૨૧૫૩૮૯ **અહીં પણ** : રેવન્યુ સર્વે નં. ૫૮૮, ૫૭૭ હાઉસ નં. ૪ળિ/૩, ગ્રીનવેલી સોસાચટી, ડ્રિમસિટી સોસાચટી પાસે, દાંદાલ,

મોજે–દાધલ, ભરૂચ, જમીનનો રેવન્યુ સર્વે નં ૧૮૦/૧–૪, રેવન્યું સર્વે નં. ૧૮૦/૧–૩, નવો રેવન્યુ સર્વ નં. ૫૮૮–૫૦૦, ક્ષેત્રફળ ૧૦૯૧૫ ચો.મી., હાઉસ નં. ૪૦//૩, ગ્રીનવેલી સોસાચટી, ડ્રિમસિટી સોસાચટી પાસે, પ્લોટ નં. ાતાલાના પુત્રનાતા તાલાવા પાસ, પલાઇ ના 3/8/૫, ક્ષેત્રફળ ૧૨૧.૯૨ ચો.મી., ક્ષેત્રફળ ૬૦.૮૨ ચો.મી. તેમજ જમીન, ટોડનો ન વહેંચાથેલ હિસ્સો, ક્ષેત્રફળ ૩૦.૬૪ ચો.મી., કુલ ક્ષેત્રફળ લ્વ.૪૬ ચો.મી., મુકામ-પોસ્ટ-દાંધલ, અંકલેશ્વર, જિલોલ-ભરૂચ-૩૯૩૦૦૦ ખાતેની જમીનનાં તમામ ભાગ અને હિસ્સા. **ચતુઃસીમા** : ઉત્તર : જગ્યા, દક્ષિણ : રોડ, પુર્વ પ્લોટ નં. ૨, પશ્ચિમ : પ્લોટ નં. ૫/૪એ

ઇન્ડ સઇન્ડ બેંદ્ર લીમીટેક વની (અધિકૃત અધિકારી)

ટ્રાઇડેન્ટ લાઇફલાઇન લીમીટેડ

(CIN: L51909GJ2014PLC078227) રજીસ્ટર્ડ ઓફ્રીસ : ૨૦૦૪, ખીજો માળ, નોર્થ એક્સ્ટેન્શન, ફાલસાવાડી, ખેગમપુરા, નોંધ-૪/૧૬૫૦, સહારા દરવાજા, સુરત, ગુજરાત

क्रोज : +६९ २६९ २४६०२२४ धनेधव : compliance@tridentlifeline.com ਪੇਯસાઈટ : www.tridentlifeline.com

૧૨મી વાર્ષિક સામાન્ય સભાની શેરહોલ્ડરોને નોટીસ આથી જાણ કરવામાં આવે છે કે કંપનીની ૧૨ (ળારમી) વાર્ષિક સામાન્ય સભા શનિવાર, રહ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ સાંજે ૦૪.૦૦ વાગ્ચે વિડિયો કોન્ફરન્સીંગ (વીસી)/અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો(ઓએવીએમ) મારફ્ત કંપની કાયદા,રંભ3ની લાગુ જોગવાઈઓ સાથે વંચાતા કોર્પોરેટ અફ્રેર્સ મંગાલચ દ્વારા જારી કરાચેલ તાજેતરના પરિપત્ર ૦૯/૨૦૨૩ તારીખ ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ સાથે વંચાતા સર્ક્યુલર નં. ૧૪/૨૦૨૦ તારીખ ૮ એપ્રિલ, ૨૦૨૦ અને સરક્યુલર નં. ૧૭/૨૦૨૦ તારીખ૧૩ એપ્રિલ, ૨૦૨૦ (એમસીએપરિપત્રો) અને સિક્ચોરીટીઝ અને એક્સચેન્૧ ળોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલ સરક્યુલર નં. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/1 તારીખ ૧૫ જાન્યુઆરી, ૨૦૨૧, સરક્યુલર નં. SEBI/HO/IDDHS/P/CIR/2022/0063 તારીખ૧૩ મે, ૨૦૨૨, સરક્યુલર નં. SEBI/HO/IDHS/DDHS-RACPOD1/P/CIR/2023/001 તારીખ૧ તન્યુઆરી, ૨૦૨૩ અને સરક્યુલર નં. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/16 તારીખ૭ ઓક્ટોળર, ૨૦૨૩ (સેળી પરિપત્રો) અન્વવે ૧૨મી એજાએમની નોટીસમાં જણાવેલ કાર્યો

૧૨મી એજીએમ ળોલાવતી નો ટીસ અને નાણાંક્રિચ વર્ષ ૨૦૨૪–૨૫નો વાર્ષિક અહેવાલ નિચત સમયે કંપનીની વેળસાઈટ www.tridentlifeline.com બીએસઈ લીમીટેડનીwww.bseindia.com અને એનએસડીએલની https://www.evoting.nsdl.com - ઉપર પણ ઉપલબ્ધ રહેશે ૧૨મી એજીએમ ળોલાવતી નોટીસની ઇલેક્ટ્રોનિક નકલ, અન્થ ળાળતોની સાથે ઇ–વોટીંગની પ્રક્રિયા અને સુચનાઓ અને નાણાંકિચ વર્ષ ૨૦૨૪–૨૫ વાર્ષિક અહેવાલ નિચત સમયે કંપની/ડિપોઝીટરીપાર્ટીશીપન્ટમાં જેસભ્યોના ઇમેઇલઆડી રજીસ્ટર્ડછે તેમને મોક્લવામાં આવશે. જેસબ્યોએ તેમના ઇમેઇલ– એડ્રેસો રજીસ્ટર્ડ કરાવેલ નથી તેઓને તે રજીસ્ટર કરાવવા વિનંતી છે - કિમેટ સ્વરૂપે શેરહોલ્કીં ગના હિસ્સામાં : તેમના કીપી(ઓ) પાસે અને

- **ફીઝીકલ સ્વરૂપે શેરહોલ્ડીંગના કિસ્સામાં**: ૧) કંપનીના રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ મેટલે કે એમચુએફ્જી ઇન્ટાઈમ ઇન્ડિયા પ્રાઈવેટ લીમીટેડ (અગાઉ લિંક ઇન્ટાઈમ ઇન્ડિયા પ્રાઈવેટ લીમીટેક તરીકે જાલીતી) ને એમચુએક્જી ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેક (અગાઉ લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેક તરીકે જાણીતી), ચુનિટ: પમો માળ, -૫૦૬-૫૦૮સ, અમરનાથ બિઝનેશ સેન્ટર-૧ (એબીસી-૧), આ ઉપરાંત ગાલા બિઝનેશ સેન્ટ-૨, સેન્ટ ઝેવિયર્સ <del>કો</del>લે૧ કોર્નર પાસે ,સી.જી. રોડ ,એલિસબ્રીજ,અમદાવાદ-૩૮૦૦૦૬ ખાતે ફોલિયો નંબર અને પાનકાર્ડની સ્વ પ્રમાણીત નક્લ સાથે લખીને.

કંપની ઈલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા તેમના હકનો ઉપયોગ કરવા માટે સભ્યોને રીમોટ ઈ-વોટીંગ સવલત પુરી પાડશે. સભ્યોને એજીએમ પહેલા અને એજીએમ દરચિમાન રીમોટ ઇ–વોટીંગની સવલતનો ઉપયોગ કરીને તેમના મત આપવાની તક મળશે. વીસી/ઓએવીએમ મારક્ત ૧૨મી એજીએમમાં જોડાવાની સુચનાઓ અને ઇ–વોટીંગની પ્રક્રિયા (ફીઝીક્લ સ્વરૂપે શેરહોલ્ડીંગ ઘરાવતા સભ્યો અથવા જેમણે તેમના ઈમેઈલ એડ્રેસો રજીસ્ટર કરાવેલ નથી તેઓ જે રીતથી ઈ-વોટીંગ મારફત તેમના મત આપી શકે છે સહીત) ૧૨મી એજીએમની નોટીસનો ભાગ ળનશે

ક્શાળ: સેંકવ

निहिता शम કંપની સેકેટરી અને ક્રમ્પ્લાયન્સ અધિકારી

ટાઈડેન્ટ લાઈફલાઈન લીમીટેડ વર્તી

(a) **pnb** Housing

૨જીસ્ટર્ડ ઓફીસ : નવમો માળ, અંતરિક્ષ ભવન, ૨૨, કે.જી. માર્ગ, નવી દિલ્હી–૧૧૦૦૦૧ ફોન : ૦૧૧–૨૩૩૫૭૧૭૧, ૨૩૫૭૧૭૨, ૨૩૭૦૫૪૧૪, વેબસાઇટ : www.pnbhousing.com જુળાગઢ શાખા : સુનિટ નં. ૧૦૨ અને ૧૦૩, પહેલો માળ, પ્લેટિનિસમ-૨, કોલેજ રોક, મોતીબાગ પારો, જુળાગઢ, ગુજરાત–૩૬૨૦૦૧ કબજા નોટીસ ( સ્થાવર મિલકત માટે)

શ્રીપીએનબી હાઉસિંગ ફાયનાન્સ લીમીટેકના નીને સહી કરના ર અધિકૃત અધિકારીએ સિક્ચોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રફ્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ હેઠળ અને એન્ફ્રોર્સમેન્ટ ઓ સિક્ચોરીટી ાબ્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ના નિયમ ૮(૧)ના અનુપાલન હેઠળ અને સિક્ચોરીટી ાબ્ટરેસ્ટ (એન્ફોરીમેન્ટ ) નિયમો, ૨૦૦૨ ના નિયમ કસાને વંચાવી કરોમ ૧૩(૧૨) હેઠળ મળતી સત્તાન ઉપયોગ કરીને સંબંધિત દેવાદા ર/સેને એકાઉન્ટની સામે જ્યાવેલ તારીખોએ માંગલા નોટીસ/સો જારી કરી એકાઉન્ટની સામે જ્યાવેલ કદમ ચુકવલા જ્યાવેલ નોટીસ/સોની તારીખ નોટીસ/સ મળ્યાળીતા રીખથી દ્રગ દિવસળી અંદર ચુકવવા જણાવ્યું હતું. દેવાદાર/સે રુગમની પસ્ત ચુકવણી કરવામાં ભિષ્ફળ ગયા હોવાથી દેવાદાર/સે અને જાહેર બનતાને જાશ કરવામાં આવે છે કે નીચે સહી કરના રે બણાવેલ ભિયમોના નિયમ ૮ સાથે વંચાતી જણાવેલ એક્ટ

કલમ ૧૩(૪) હેઠળ તેતિથીને ૧૫૫ સત્તાનો ઉપયોગ કરીને નીચે જણાવેલ મિલકત/તોનો કબજો એકાઉન્ટ સામે જણાવેલ તારીખોએ લઇલીધો છે. ખાસ કરીને દેવાદાર/શે અને જાહેર જનતાને મિલકત/તો સાને સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલકત સાનેનો કોઇપણ સોદો પીએનળી હાઉસિંગ ફાચનાન્ય લીમીટેકની રકમ અ

લોન એગીમેન્ટ મુજબ તેના પરના વ્યાજના સાર્જને આદિાન રહેશે.

સિક્ચોર્ડ મિલકતો પસ્ત મેળવવા માટે ઉપલબ્ધ સમયમર્યાદામાં એક્ટનીકલમ ૧૩ નીપેટા કલમ (૮) ની જોગવાઇઓ પ્રત્યે દેવાદારોનું ધ્યાન દોરવામાં આવે છે. ન એકાઉન્ટ દેવાદાર/ , માંગ્રણા

નંબર	શ્વમુનિદારનું નામ સંહ–દવાદાર/	વારીખ	બાકારકમ	તારીખ તારીખ	ગીરો મિલ <del>ક</del> તની વિગત
NHL/JNGD/ 0720/80092 5 SII'MI: YGII'AS	શ્રીસુરેશ આર.વિરવાણી અર્જ શ્રીમતી ભારતી સુરેશભાઇ વિરવાણી	5058	ફા.૧૧,૨૬,૪૧૬,૮૪/– (રૂપિયા અગિયા ર લાખ છલ્લીસ હજાર ચારસો સોળ અને ત્રીયશિ પૈસા પુરા) ૦૧–૧૦–૨૦૨૪ મુજબ		જ્ઞોપ વં. ર, તિન્દ્રેશ્વર પેલેસ, નિન્ની બારી દલાઇલામા, મંગનાન રોડ, મંગનાન રોડ, જુનાગઢ, ગુજરાત– ૩૬૨૦૦૧,ભારત
સ્થાળ : જુનાગઢ	, તારીખ : ૦૩.૦૯.૨૦૨૧	4	સહી	)/- ନାମ୍ପର୍ହିଦ ନା I	l હિકારી, પીએનબી હાઉસિંગ ફાયનાન્સ વીમીટેડ

#### ઓર્વેલ સ્ટેઝ લીમીટેડ

જીરહર્ક ઓફીસ: ગ્રાઉન્ડ ફ્લોર- ૦૦૧, મીચોંશ એલ્ઝાઝા, શ્લામલ ક્રોરા રીક, પારેખ હોરપીકલ પાસે, સેકેલાઇઢ, અમહાવાદ, ગુજરાત- ૩૮૦૦૧૫, ભારત. કોર્પોરેઢ ઓફીસ: ચોથો ગાળ, રોઝા પ્લાઝો, સેક્ક્કર દૂદ, ગુરુગામ, હરિયાણા, ૧૨૦૦૦૧, ભારત. cin:us30906.J2012FLC 107088 કુંગ નં∷ ૭૯- મ્યન્ડ ૦૫૦૬૦ અને ૦૧૨૪- ૪૪૮૭૨૫૩ secretarial@oyorooms.com | www.oyorooms.com

<u>નોટીસ</u>

વિકિયો કોન્ફર ન્સીંગ/અન્ય ઓહિયો વિઝયુઅલ માધ્યમો મારફત યોજાનાર કંપનીની ૧૪મી વાર્ષિક સામાન્ય સંભા સંબંધિત માહિતી

માથી નોટીસ આપવામાં આવે છે કે ઓર્વેલ સ્ટેઝ લીમીટેડ( કંપની)ની ૧૪મી વાર્ષિક સામાન્ય સભા શુક્રવાર, રફ સપ્ટેમ્બર, ર૦૨૫ ના રોજસાંજેપ:૩૦ ગાગ્ચે વિડિયો –કોન્ફરન્સીંગ/અન્ય ઓડિયો–વિગયુઅલ માધ્યમો (વીસી/ઓએવીએમ) મારફત એક જ સ્થળે સભ્યોની પ્રત્યક્ષ હાજરી વગર કંપની કાચદા, ૨૦૧૩(એક્ટ)અને તે હેઠળ બનેલ નિચમોની લાગુ જોગવાઈઓ સાથે વંચાતા સમયાંનુંસાર કોર્પોરેટ અર્ફર્સ મંત્રાલય (એમસીએ) દ્વારા જારી કરાચેલ લાગુ પરિપત્રાના અનુપાલન હેઠળ ૧૪મી એજીએમની નોટીસમાં જણાવેલ કાર્ચો પાર પાડવા માટે ચોજાશે. વીસી/ઓએવીએમ મારફત એજીએમમાં હાજર રહેનાર સભ્યોને એક્ટની કલમ ૧૦૩ હેઠળ કોરમની ગણતરી માટે ધ્યાનમાં લેવામાં આવશે. એજીએમની નોટીસ તેમજ નાણાંકિચ વર્ષ, ૨૦૨૪–૨૫ નો વાર્ષિક અહેવાલ સભ્યો જેમના ઇમેઇલ એડ્રેસો કંપની/આ૨ટીએ/ડિપોઝીટરી પાર્ટીશીપન્ટો પાસે રજીસ્ટર્ડછે તેમને ક્ક્ત ઈમેઈલથી મોક્લવામાં આવશે.

જેસભ્યોએ તેમના ઈમેઈલ એડ્રેસો રજીસ્ટર્ડ/સુધારો કરાવેલ નથી તેઓએ નીચેના પગલાં અનુસરવા જરૂરીછે : ફીઝીક્લસ્વરૂપે શ્રેરહોલ્ડીંગ ધરાવતા સભ્યોને ફોલિયો નંબર,નામ, શેર સર્ટી ફીકેટની સ્કેન્ડ નક્લ (આગળ અને પાછળ),પાન અને આધાર કાર્ડની સ્વ–પ્રમાણિત નકલ, કંપનીના આરટીએને <u>rnt.helpdesk@linkintime.co.in/enotices@in.mpms.mufg.com</u> અથવા કંપનીને <u>secretarial@oyorooms.com</u> ઉપર ઇમેઇલ કરીને પુરી પાડવા વિનંતી છે. સભ્યોએ નોંધ લેવી કે આ નો ટીસની તારીખ

ના રોજ, તમામ શેર્સ કક્ત ડીમીટરીયલાઝડ હોલ્કીંગના છે. ડીમટીટી ચલાઇઝક સ્વરૂપે શેરો ધારાવતા સભ્યોને ડિપોઝીટરી પાર્ટીશીપન્ટ જેતેમના ડિમેટ એકાઉન્ટનું સંચાલન કરતાં હોય તેમની પાસે તેમન

ઇમેઇલ એડ્સો રજીસ્ટર્ડ /સુધારો કરાવાવિનંતીછે. ની ૧૪મીએજીએમની નોટીસમાં જણાવેલ ઠરાવો પર છલેક્ટ્રોનિક માધ્યમો (એટલેકે એજીએમ પહેલા રીમોટ ઈ–વોટીંગ અને એજીએમ દરમિયા ઇ–વોટીંગ) દ્વારા મત આપવાના તેમના હકનો ઉપયોગ કરવા તેના સભ્યોને સવલત પુરી પાડી રહી છે. વીસી/ઓએવીએમ મારફત એજીએમમાં જોડવાની સચના અને ઇ-વોટીંગની પ્રક્રિયા( જેરીતે કીઝીકલ સ્વરૂપે શેરહોલ્ડીંગધરાવતા સભ્યો અને જેમણે તેમના ઇમેઇલ એડેસ રજાસ્ટર્ડ કરાવ્ય નથી તેઓ ઇ-વોટીંગ મારફત મત આપી શકે છે) એજીએમની નોટીસનો ભાગ ળનશે. સભ્યોને એજીએમની નોટીસમાં જણાવેલ તમામ નોંધો અને ખાસ કરીને એજીએમમાં જોડવા માટેની સુચનાઓ અને ઈ-વોટીંગ મારફત મત આપવાની રીત ધ્યાનથી વાંત્રવા વિનંતી છે. સભ્યો ફક્ત વીસી/ לאליואים אינופיי אום ביין אלימיליומין מלבות פול על איל מוום פת פול על

૧૪મી એજાએમ ળોલાવતી નોટીસ અને નાણાંકિય વર્ષ ૨૦૨૪–૨૫ નો વાર્ષિક અહેવાલ કંપનીની વેળસાઇટ https://www.ovorooms.com/investor-relations અને મેસર્સ એમચુએક્જી ઇન્ટરાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ (અગાઉ લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રા. લી.) ની વેબસાઇટ એટલે કે <u>https://instavote.linkintime.co.in</u> ઉપર પણ ઉપલબ્દા રહેશે.

આ નોટીસ કોર્પોરેટઅફેર્સ મંગાલચના લાગુ પરિપત્રોના અનુપાલન હેઠળ અને કંપનીના તમામ સભ્યોની માહિતી અને લાભાર્થે જારી કરવામાં આર્વ ઓવેલ સ્ટેઝ લીમીટેક વર્તી

શિવમ કુમા

તારીખ: ૦૧ .૦૯ .૨૦૨૫

રથળ: ગુરૂઆમ

કંપની સેકેટરી અને કમ્પ્લાયન્સ અધિકારી

## केनरा बैंक 🕸 Canara Bank ઈ–હરાજી વેચાણ નોટીસ

સ્પેશીયલાઈઝ ક એઆસ્એમ બ્રાન્ચ ૨ ચેજ્ઞાઇ (૭૯૦૧) નં. ૯ અને ૧૦, સર થયા ગ્રાયા રોક, થયાગ્રાયા નગર, ચેજ્ઞાઇ-૬૦૦ ૦૧૭ મો. : ૯૭૪ ૦૧૪૫૬૨૨ **វេទាំ៩៤:** cb7901@canarabank.com

સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮ (ફ) ની જેગવાઇએ સાથે વંચાતા સિક્ચોરીટાઇઝેશન અનેરીકન્સ્ટ્રક્શન ઓફ્ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ નિયમો, ૨૦૦૨ હેઠળ સ્થાયર મિલકતોના વેચાણ માટે ઈ–હરાજી વેચાણ નોર્ટીસ ઝાથી ખાસ કરીને દેવાદાર(રો)અને જામીનદાર(રો)અને જાહેર જનતાને આથી નોટીસ આપવામાં આવે છે કે નીચે દર્શાવેલ સ્થા**વ** મિલકતનો સિક્યોર્ડ લેણદારને ગીરો/ચાર્જ કરાયેલ છે, જેનો સ્થનાત્મક/સાંક્રેતિક/ભૌતિક કબજો કેનરા બેંકના સ્પેશીયલાઇઝ

એઆરએમ ર ધ્રાન્થ (૩૯૦૧) ના અધિકત અધિકારીએ લઇ લીધો છે. "જે જ્યાં છે". "જે છે" અને "જેમ છે" ના ધોરણે રદ .૦૯ .૨૦૨૧ **ના રોજ( સવારે ૧૧.૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી)** ( વેચાણ પુર્ણ થાય ત્યાં સુધી પ્રતિદિઠ ૫ મિનિટના ઓટો એક્સટેન્શન સાથે) નીચેન દેવાદારો/જામીનદારો પાસેથી બેંકની બાકી રકમની વસુલાત માટે વેચવામાં આવશે.

દેવાદાર નું નામ અને સરનામું: (૧) મેસર્સ ગ્રીન ઓ ક્રેર એન્જિનિયરીંગ પ્રાઈવેટ લીમીટેડ. રજીરટર્ડ ઓફીસ: નં. ૫૫, ૫હેલો માળ કામરાજ એવન્યુ, પહેલી શેરી, કસ્તુરળા નગર અદચાર, ચેજ્ઞઇ-૬૦૦ ૦૨૦, **ફેક્ટરી ઓફીસ**: ફેક્ટરી: સર્વે નં. ૧૨૪/એ૨ સિરાનસાલુર ગામ, મધુરંથાગમ તાલુકો, ચેનંગલ્પેટ જિલો ૬૦૩ ૩૦૯ **તેના ડાયરેકર( ર્સ) ના પ્રતિનિધિત્વમાં, ૨) શ્રી વી ક્રશન જે કે વેકંટરામણના પુત્ર,** ૯૫, ચીરથાગીરી રોડ, સાલેમ –૬૩૬૦૦૧, તમિલનાડુ, **૩) શ્રીમતી કે રેણુકા જે વી કજનના પત્ની, જે** ૩૦૩, ાદ્રપ્રસ્થ-૫,પ્રહલાદનગર,એચર્ડીએ ફ્સી બેંકપાસે,અમદાવાદ- ૩૮૦૦૧૫,ગુજરાત,**૪) શ્રી વી ક્રેજ્ઞના જે વેકંટરામણના પુત્ર,** ફ્લે નં. 3એ નં. 34, વેંકાથીનન નગર, અદચાર, ચેજ્ઞાઇ-૬૦૦૦૨૦

કુલ બાકી રકમ : રૂા. ૩૭,૮૧,૫૦,૭૩૪.૬૭/– (રૂપિયા સાડગ્રીસ કરોડ એક્યાસી લાખ પચ્ચાસ હજાર સાતસો ચોત્રીસ અને સક્સઠ પૈસા પુરા) ૩૧.૦૮.૨૦૨૫ મુજબ વત્તા તેના પરના ચકત વ્યાજ અને આકસ્મિક ચાર્જિસ સ્થાવર મિલકતની વિગત :

**મિલકત ૧: પ્રકાર: રેસીડેન્સીયલ સહ ઇન્ડરટ્રીય બિર્લ્ડીંગ** : મિક્સ્ડ જમીન (૧.૧૦+૨.૧૦=૩.૨૦ એક્ટ અથવા ૧૩૯૩૯૨ ચો.કુટ) અને રેસીડન્સીચલ / ઇન્ડસ્ટ્રીચલ બિલ્ડીંગ (આરસીસી ગ્રાઉન્ડ ફ્લોર સ્ટપ્ક ચો.કુટ+ ગાલ્વેલમ શ્રીટ (ગ્રાઉન્ડ ફ્લોર) ૧૮૪૭૫ ર્ચો.કટ), બીજો માળ: ૧૪૪/૨બી૧બી (૧.૧૦ એક્ટ),૧૪૪/૨બી૨બી (૨.૧૦ એક્ટ) વડકાયાનપટ્ટી ગામ, પેયનાઈકેન્પલયમ તાલકે સાલેમ જિલા ખાતેની શ્રી વી. કાજ્ઞન, ડાયરેક્ટરના નામે રહેલ સાલેમ જિલો, સાલેમ (પૂર્વ), રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ વાઝાપડી સબ ૨જીસ્ટ્રેશન કિસ્ટ્રીક્ટ, વદુગાથમ્પથી ગામ ખાતેની મિલકત**. વિગત નં.૧**: સર્વે નં.૧૪૪/૨ળી૧ળી: ચતુ:સીમા: ઉત્તર: કાર્ટ ટ્રેક/રોડ દક્ષિણ:આંગનની જમીન અને અન્ય , પુર્વ: પાર્વથીની જમીન , પશ્ચિમ: નીચે વિગત નં. ૨ જુઓ **વિગત નં. ૨** : ક્રમ નં. ૧૪૪/૨ળી૨બી: ચતઃસીમાઃ ઉત્તરઃ કાર્ટ ટેક/રોક. ઉમિચાલપરમ પચીચાચે કોવિલ. દક્ષિણ: લક્ષ્મણન અને અન્ય ની જમીન, પર્વ: ઉજ્ઞામલાઈની જમીન અને ઉપર જમઆવેલ વિગત ન.૧, પશ્ચિમ : ઉજ્ઞામલાઈની જમીન અને સર્વે નં. ૧૪૪/૨ળી૨ની બાકીની જમીન

રિઝર્વ કિંમત રૂા. ૪,૩૨,૨૧,૧૦૦/- છમેમડી રૂા. ૪૩,૨૨,૧૦૦/- બિડ વૃદ્ધિની ૨૬મ રૂા. ૧,૦૦,૦૦૦/-મિલકત **૨: ટાઈપ : રેસીડેન્સી યલ બિલ્કીં ગ**: મિક્સ્ડ જમીન ( શપર૦ ચો.કુટ), અને બિલ્કીંગ (ગ્રાઉન્ડ ફ્લોર+ પહેલો માળ+ બીજે માળ = ૫૦૩૫ ચો.ક્ટ), ડી. નં. ૬૨/૩, ભારથીચાર, ૩જ઼ શેરી, અમ્માપેટ ગામ. સાલેમ કોર્પોરેશન. લોર્ડ-એજેમાં. બ્લોક- ૧૧. ટાઉન લાનિંગ સર્વે નં. ૮/૨ અને ૮/૩, નવો ટાઉન પ્લાનિંગ રર્વે નં. ૮/૨ જેઅને ટાઉન પ્લાનિંગ સર્વે નં. ૮/૩બી, મિલીટરી રોડ, અમ્માપેટ ામ, જેડિવિઝન, ૧૦મો વોર્ડ, સાલેમ, શ્રી વી કાજ્ઞન, ડાચરે ક્ટરના નામે રહેલ સાલેમજોઇન્ટ ૧ સબ રજીરદેશન ડિસ્ટ્રીક્ટ અને સાલેમ કિસ્ટ્રીક્ટપૂર્વ રજીસ્ટ્રેશન ખાર્તની મિલકત. **ચતુઃસીમા**: ઉત્તર: વોર્ડ એ જેમાં ખાલી જાીન, બ્લોક ૧૧, ટાઉને પ્લાનિંગ સ્કીમ નં. ૮/કરે અને ટીએસ નં. ૮/3 સી, મનીક્લ મુકલાિસ્ટની માલિકની, દક્ષિણ: વોર્ડ –એજમાં ઘારની મિલકત, બ્લોક ૧૧, ટાઉને પ્લાનિંગ સ્કીમનં ૮/૨ જે, વિજ્યાલસ્ત્રીની માલિકીની અને વોર્ડ-એજે માં ઘરની મિલક્તો, બ્લોક્- ૧૧, ટાઉન પ્લાનિંગ સ્ક્રીમ નં. ૮/૩ જે કારૂન અને સરસ્વતીની માલિકીની મિલક્ત. પુર્વ:૧૫ કુટ રોડ, દક્ષિણ:ઉત્તર:કોમન રોડ, પશ્ચિમ:પુર્વ પશ્ચિમ:૩ કુટ પહોળો, દક્ષિણ:ઉત્તર:ડ્રેને૧

રિઝર્વ કિંમત રા.૧,૯૧,૯૦,૦૦૦/- છોમડી રા.૧૯,૧૯,૦૦૦/- બિડ વૃદ્ધિની રકમ રા.૧,૦૦,૦૦૦/-મિલકતના નિરિક્ષણની તારીખ અને સમસ: ૨૨.૦૯.૨૦૨૫ ના રોજસવારે ૧૧.૦૦ થી સાંજે૪.૦૦ વાગ્યા દરમિયાન

ઈએમડી જમા હરવાની છેલી તારીખ: ઇચ્છુહ બીડરા અનેંસ્ટ મની ડિપોઝીટ(ઈએમડી) સીધા મેસર્સ પીએરાબીએલાયન્સપ્રાઈવેટ લીમીટેડ (ખેન્કનેટ) પોર્ટલના ઈ-વોલેટમાં રીઝર્વ ફિંમતના ૧૦ ટકા ઉપર જણાવેલ ૨૧.૦૯.૨૦૨૧ ના રોજ સાંજે ૧.૦૦ વાગ્યે અથવા એ પહેલા જમા કરવાની રહેશે. સવારે ૧૧.૦૦ થી બપોરે ૧૨.૦૦ વાગ્યા દરમિયાન ઈ-હરાજીની તારીખ અને સમય ૨૬.૦૯.૨૦૨૫

પ્રતિદિઠ ૧ મિનિટના અમર્યાદિત લંબાણ સારો વેચાણની વિગતવાર શરતો અને નિયમો માટે કેનરા ખેંકની વેખસાઈટ ( www.canarabank.com) માં આપેલ ઈ- હરાજી લીંક જોવા વિનંતી છે અથવા સ્પેશીયલાઈઝડ એઅદિએમ ૨ શામા (૭૯૦૧) ચેરાઈ, નં.૯ અને૧૦, સર થયાગર યારોડ, થયાગર ચેજ્ઞઈ-૧૭, મોખાઈલ: ૯૭૪૦૧૪૧૬૨૨, ઈમેઈલ : cb7901@canarabank.com (અચવા) ખેન્કનેટ પોર્ટલ (મેસર્સ પીએસખી

એલાયન્સ પ્રા.લી.) નો સંપર્ક કરી શકે છે. તમે ખેન્કનેટના હેત્પડેસ્ક સપોંટનો સંપર્ક કરી શકો છો. સંપર્ક વિગતો: ૮૨૬૧૨૨૦૨૨૦ ઈમેઇલ: support.BAANKNET@psballiance.com ્નો સંપર્ક કરી શકાશે. ઈ–હરાજી પોર્ટલ: https://baanknet.com તારીખ : ૦૧.૦૯.૨૦૨૫

અદાિકૃત અદિાકારી

ક્**ખજા નોટીસ** (સ્થાવર મિલકત માટે) નિચમ ૮ (૧)

દેવાદાસ ગે) સહ-દેવાદાસ શે)નું નામ શ્રી દિલીપભાઇ નવલસિંગભાઇ સહવા, શ્રીમતી શુસખળન સહવા પ્રોટ પેન્ક નં. આઇએલ ૧૦૦૨૯ દ્દલ્	સિક્યોર્ક મેરોટ્સની વિગત(સ્થાવર મિલકત)	કુલ બાકી રક્મ (રૂા.) માં	બોટીસની તારીષ ૨૧-૦૪- ૨૦૨૫	डल्डनी वारीष २८- २८- २०२५
	પ્લોટનં. ૨૬, બ્લોક નં. ૧૫૯/૨૬, સર્વે નં. ૧૭૮ પૈકી,૧૮૧/૧ અને	MANUFACTURE OF THE PARTY OF THE		
	૧૮૨૪, શ્રી સાંઇ વિદા સોંસાચટી, બારામ ધિટ, ઇતાલપો રગામ પાસે, આટોન્ન સેક, ઓલપાડ, તાલુકો સુરત , ગુજરાત, તારત– ૩૯૪૧૦૦ ખાતેની મિલદતના તમામ ભાગ અને હિસ્સા. એરિયા સેંગ્રફળ (ચો. ફૂટ) - મિલકનો પ્રકાર 'જમીન એરિયા, બિલ્ટ અપ એરિયા, કર્પોર્ટ એરિયા મિલકત એરિયા : ૭૭૮૦૨, ૫૫૦,૪૫,૭૦૦.૦૦	હજાર બસ્સો એકવીસ પુરા)		

ાધુ લિગતો માટે શાખા ઓ ફીસના અધિકૂત અધિકારીનો સંપર્ક કરતા વિનંતી છે. શા<mark>ખા ઓફિસ : ઓફિસ નં. ૭૦૧, સાતમો માળ, ૨૧ રોન</mark> બે**ઝનેસ સેન્ટર, ઉલના દરલાજા પાસે, રીંગ રોક, સુરત – ૩૯૫૦૦૨ અને કોર્પોરેટ ઓફિસ :** પ્લોટ નં. ૯૮, ફેઝ–૪, ઉંઘોગ વિહાર, ગુર

સહી/– અધિકૃત અધિકારી, આઇઆઇએફએલ હોમ ફાયનાન્સ લીમીટેક વર્ત

## **બ્રોચ લાઈકકેર હોસ્પિટલ લીમીટે**ડ

(CIN: L86100GJ2023PLC140499) રજીસ્ટર્ડ ઓફ્રીસ :૧૦૧, પાંચમો માળ, ક્રોપોરેટ હાઉસ, ભરૂંચ ઓચોંપેડીક્ર હોરિપટલ ઉપર, આર કે કારટા, ભરૂચ-૩૯૨૦૦૧, ગુજરાત, ભારત ઈંગ્રેઇલ આઈડી : info@maplehospital.in ફોન: +લ્૧ ૯૪૨૯૧૮૭૨૨૬

વેબસાઈટ: www.maplehospital.in વિકિયો કોર્ન્ફરન્સીગ (વીસી)/અન્ય ઓકિયો વિઝયુઅલ માધ્યમો (ઓએવીએમ) મારફત ચોજાનાર બીજી વાર્ષિક સામાન્ય સભાની નોટીસ

. આથી નોટીસ આપવામાં આવે છે કે કંપનીની ળીજી વાર્ષિક સામાન્ચ સભા (એજીએમ) ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજસવારે ૧૧:30 વાગ્યે વિડિયો કોન્કરન્સી/અન્ય ઓડિયો વિડિયો માધ્યમો માર ક્લ કંપની કાયદા, રળ 3ની લાગ જોગવાઈઓ અને તે હેઠળ બનેલ નિયમો અને સેળી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને કિસક્લોઝર રીક્વાચરમેન્ટ્સ) નિચમનો, રબપ સાથે વંચાતા આ સંબંધમાં પેહાલ જારી કરાચેલ સરક્યુલર્સ સાથે વંચાતા જનરલ સરક્યુલર નં. ૦૯/૨૦૨૪ તારીખ ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ (એક સાથે એમસીએ પરિપગો તરીકે દર્શાવેલ છે) અને સિક્ચોરીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેળી) દ્વારા આ સંબંધમાં જારી કરાયેલ જુના સરક્યુલર્સ સાથે વંચાતા સરક્યુલર્સ નં. SEBI/HO/CFD/CFD-POD-2/P/CIR/2024/133 તારીખ 3 ઓક્ટોબર ૨૦૨૪ (એક સાથે સેળી પરિપગો તરીકે દર્શાવેલ છે) ના અનુપાલનમાં ળોલાવામાં આવશે ંસંબંધિત પરિપત્રોના અનુપાલનમાં, એજીએમની નોટીસ તેમજ નાણાંક્ચિ વર્ષ, ૨૦૨૪–૨૫ ને વાર્ષિક અહેવાલ કંપનીના તમામ સભ્યો જેમના ઇમેઈલ એડ્રેસ(સો) કંપની/ડિપોઝીટરીપાર્ટીશીપન્ટ પાસે રજીસ્ટર્ડ છે તેમને ઈલેક્ટ્રોનિકલી મોકલવામાં આવશે. ઉપરોક્ત દસ્તાવેજો કંપનીની વેળસાઇટ https://maplehospital.in/investor-Relations.aspx સ્ટોક એક્સચેન્જ એટલે કે ળીએસઈ લીમીટેડની www.bseindia.com અને એનએસડીએલની વેળસાઈટ એટલે www.evoting.nsdl.com ઉપર પણ ઉપલબ્ધ રહેશે.

ડિમેટ સ્વરૂપે શેરહોલ્ડીંગ ધરાવતા શેરહોલ્ડરે જેમણે તેમના ઈમેઈલ એડ્રેસો રજીસ્ટર્ડ કરાવેલ નર્થ તેઓ તેમના સંબંધિત કિપોઝટીરી પાર્ટીશીપન્ટ( ટો ) પાસે તેમના ઇમેઈલ એડ્રેસ રજીસ્ટર કરાવી શ્વકે છે. ફીઝીક્લ સ્વરૂપે શેર્સ હોલ્ડીંગ ધરાવતા શેરહોલ્ડરોને ફોર્મ નં. આઈએસઆર-૧ માં અને અન સંબંધિત ફોર્મ અને દસ્તાવેજો સહીત einward.ris@kfintech.com ને અરજી મોક્લીને તેમના ઈમેઈલ એડ્રેસો અને અન્ય કેવાયસી વિગતો , જો લાયુ હોય તો રજીસ્ટર/સુધારો કરાવવા વિનર્ત **झेर्म आर्धभेसआर-१नो नमुनो डे**झीन टेड नी https:/ris.kfintech.com/clientservices/isc/isforms.aspx ઉપર ઉપલબ્ધ છે.

શેરહોલ્ડરોને ઇલેક્ટ્રોનિંક મતદાન પદ્ધતિ મારફત એજીએમની નોટીસમાં જાયાવેલ કામકાજો પ એજએમ પહેલા અને એજએમ દરમિયાન રીમોટલી તેમના મત આપવાની તક મળશે ડિમટીરીચલાઇઝડ સ્વરૂપે અને ફીઝીકલ સ્વરૂપે શેર્સહોલ્ડીંગ ધરાવતા શેરહોલ્કરો અને જેમણે તેમના દીમેઈલ આઈડી રજાસ્ટર્ડ કરાવેલ નથી તેવા શેરહોલ્ડરો માટે એજીએમ પહેલા અને એજીએમ

દરમિયાન રીમોટલી મત આપવાની રીત શેરઠોલ્ડરોની નોટીસમાં આપેલ છે. શેરહોલ્ડરો નોંધ લેવી કે ઉપરોક્ત પરિપગો અનુસાર, કંપની શેરહોલ્ડરોને એજીએમ નોટીસ અને વાર્ષિક અહેવાલની કીઝીકલ નકલો મોકલશે નહી. **બ્રોચ લાઈફક્રેર હોરિપટલ લીમીટેડ વર્ત** સહી/

તારીખ: ૦૧.૦૯.૨૦૨૫ રથળ: ભરૂચ

કો.જયહૂમાર નરેન્દ્ર વ્યાર મેનેજિંગ કાયરેક્ટર ડીઆઈએન: ૦૮૭૩૬૩૮૭

### કલાના ઈસ્પાત લીમીટેડ

(CIN: U27100GJ2012PLC072306) રજીસ્ટર્ડ ઓફ્રીસ : સી-૯૧૮, , વિનસ સ્ટારટમ, ઝાંસી ક્રી રાણી સ્ટેચ્યુ પાસે, नहेरानगर, समहावाह-३८००१ ४ क्रोन: ६१-८१४१८ ४८१४६ र्धभेर्धलः compliance@kalanaispat.com क्रोनः ०७६-४६२०८०४५ વેખસાઈટ: http://www.kalanaispat.com

૧૩મી વાર્ષિક સામાન્ય સભાની નોટીસ,

ઈ-વોટીંગ અને બુકબંધ માહિતી <mark>ખા</mark>થી નોટીસ આપવામાં આવે છે <del>કે ક</del>લાના ઇસ્પાત લીમીટેડના સભ્યોની ૧૩મી વાર્ષિક સામાન્ય સભ શનિવાર, ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ બપોરે ૧૨:૩૦ વાગ્યે ભારતીય સમય પ્રમાણએ વિડિયો <del>કો</del>ન્કરન્સી (વીસી)/અન્ય ઓડિયો વિડિયો કોન્કરન્સીંગ (ઓએવીએમ) મારક્ત નોટીસ તારીખ વ

સપ્ટેમ્બર, ૨૦૨૫ માં જણાવેલ કામકાજો પાર પાડવા માટે ચોજાશે. <mark>એ</mark>મસીએ અને સેબી પરિપત્રોના અનુપાલનમાં, એજીએમની નોટીસ અને નાણાંક્રિય વર્ષ ૨૦૨૪–૨૦૨૧ <mark>નો</mark> કંપનીના વાર્ષિક અહેવાલની ઈલેક્ટ્રોનિક નક્લો સભ્યો જેમના ઈમેઈલએડ્રેસો કંપની/ડિપોઝીટરીઓ પાસે રજીસ્ટર્ડ છે તેમને મોકલેલ છે. આ દસ્તાવેજો કંપનીની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે અને કંપનીની વેબસાઈટ www.kalanaispat.comઅને સ્ટોક એક્સરોન્જ એટલે કે નેશનલ સ્ટોક એક્સરોન્જઓ ક ઇન્ડિયા લીમીટેડની વેબસાઈટ www.nseindia.com ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. ઇમેઈલ માર કત એજીએમની રવાનગી ૧ સપ્ટેમ્બર, રુગ્યના રોજ પૂર્ણ કરાયેલ છે. વીસી/ઓએવીએમ મારફત એજુએમમાં હાજ્ટ રહેનાર સભ્યોને એક્ટની ક્લમ ૧૦૩ હેઠળ કોરમની ગણતરી માટે ધ્યાનમાં લેવામાં

<mark>રી</mark>મોટ ઈ-વોટીંગનો સમય ગાળો બુધવાર, ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ શરૂ થશે અને શુક્રવાર, સપ્ટેમ્બર, રુ રપ ના રોજસાંજેપ.૦૦ લાગ્યે પૂર્ણ થશે. આ સમયગાળા દરમિયાન, કટ-ઓફ તારીખ સ્વ સપ્ટેમ્બર , રુસ્પ ના રોજિકમટીરીયલાઈઝડ સ્વરૂપે શેર્સ હોલ્ડીંગ ધરાવતા કંપનીના સભ્યો એજીએમની <mark>નો</mark>ટીસ તારીખ ૦૧ સપ્ટેમ્બર ,રુસ્પમાં જણાવેલ કામકાજો પર રીમોટ ઈ-વોટીંગથી તેમના મત આપી <mark>શ</mark>ક્શે. નોટીસ અને વાર્ષિક અહેવાલની સોપ્ટ નક્લોની રવાનગી પછી કટ-ઓફ તારીખ ૨૧ સપ્ટેમ્બ<mark>ર</mark> રુગ્ય પછી કંપનીના શેરો પ્રાપ્ત કરનાર અને કંનપીના સભ્ય બનનાર કોઈપણ વ્યક્તિ રીમોટ ઈ-વોટીંગની પ્રક્રિયા અનુસરી શકે છે. રીમોટ ઈ-વોટીંગ મોડ્યુલ ત્યારબાદ નેશનલ સિક્યોરીટીઝ ડિપોઝીટરી લીમીટેડ દ્વારા બંધ કરવામાં આવશે. સભ્યએ ઠરાવ પર એક વખત મત આપ્યા પછી , સભ્યને કરીથી તેમાં કેરકાર <del>ક</del>રવાની પરવાનગી મળશે નહી.

રુ સપ્ટેમ્બર, રુરપ ના રોજ વિડિયો કોન્ફરન્સીંગ ( વીસી)/અન્ય ઓડિયો વિડિયો કોન્ફરન્સીંગ (ઓએવીએમ) માર ફ્ત એજીએમાં ભાગ લેનાર સભ્યો એનએસડીએલની ઈલેક્ટ્રોનિક વોટીંગ સીસ્ટમ ઈ–વોટીંગ) મારફત એજીએમની નો ટીસમાં જણાવેલ કામકાજોપર ઈલે ક્ટ્રો તેમના મત આપી શકે છે

શેરહોલ્ડરો/રોકાણકારોને વર્ચ્યુઅલ સભા સંબંધિત કોઈપણ પ્રશ્ન હોય તો, તેઓ ડાઉનલોડ સેક્શન હેઠળ https://www.evoting.nsdl.com પર ઉપલબ્ધ કીકવન્ટલી આસ્ક્ડ ક્વેશન્સ (એફએક્યુએસ) જોઈ શકે છે અથવા તમે evoting@nsdl.com ઉપર અમને ઈમેઈલ કરી શકો છો મથવા અમને ૦ ૨૨ ૪૮૮૬ ૭૦૦૦ ઉપર કોલ કરવો

<mark>બુ</mark>ક બંધ: કંપની કાયદા, રુ૧૧ ૩ની કલમ૯૧ અન્વયે, કંપની ના રજીસ્ટર ઓફ મેમ્બર્સ અને શેર ટ્રાન્સફ્ બુક્સ રવિવાર, ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી શનિવાર, ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી ( બંને દિવસો સહીત) વાર્ષિક સામાન્ય સભાના હેતુસર અને જો એજીએમમાં ઘોષણા થાયતો ડિવિડન્ડની ચુક્વણી કરવા માટે લાયક શેરહોલ્ડરો નક્કી <del>ક</del>રવા માટે બંધ રહેશે. . બોર્ડના આદેશથી

કલાના ઈસ્પાત લીમીટેડ વતી વર્શિસ જોસેક પોટરટર્લી તારીખ : ૦૧.૦૯.૨૦૨૫ મેનેજિંગ ડાયરેક્ટર

સહી/-

ડીઆઇએન: ૦૨૭૭૧૫૭૮

સ્થળ : અમદાવાદ

#### DEEM EGGL TEGG ડીમ રોલ–ટેક લીમીટેડ CIN No.: U27109GJ2003PLC042325

**રજીસ્ટર્ડ ઓફીસ**: સર્વે નં. ૧૧૦/૧, પી–૧, ૧૧૦/૨, ગણેશપુરા, તાલુકો–કડી, િલ્લો મહેસાણા, ગુજરાત, ભારત, ૩૮૨૭૨૯. કોર્પોરેટ ઓફીસ: સી-૧૨૧૨, સ્વાતી ત્રિનીટી, એપલવૂડ ટાઉનશીપ પાસે, એસ.પી રીંગ રોક, અમદાવાદ, ગુજરાત-3૮૦૦૫૮. ઇમેઇલ: cs@deemrolls.com, વેબસાઇટ: www.deemrolls.com

વિકિયો કોન્ફરન્સીંગ ( વીસી)/ અન્ય ઓડિયો વિઝયુઅલ માધ્યમો ઓએવીએમ) મારફત યોજાનાર રસ્મી વાર્ષિક સામાન્ય સભાની નોટીસ . આથી ડીમ રોલ–ટડેક લીમીટેડના સભ્યોની ૨૨મી. વાર્ષિક સામાન્ય સભા શક્વાર, ૨૬ સપ્ટેમ્બર

૧૦૨૫ ના રોજસવારે ૧૧:૩૦ વાગ્ય વિડિયો કોન્ફરન્સીંગ/અન્ય ઓડિયો વિઝયુઅલ માધ્યમો (વીસી/ઓએવીએમ) સવલત મારફત ૨૨ એજીએમ ળોલાવતી નોટીસમાં જણાવેલ કાર્ચો પાર પાડવા માટે કંપની કાયદા , રભ ૩ અને તે હેઠળ બનેલ નિયમોની લાગુ જોગવાઈઓ સાથે વંચાતા કોર્પોરેટ અફર્સ મંત્રાલય (એમસીએ) દ્વારા જારી કરાયેલ સરક્યુલર નં. ૧૪/૨૦૨૦ તારીખ ૮ એપ્રિલ, ૨૦૨૦, સટક્યુલર નં. ૧૭/૨૦૨૦ તારીખ ૧૩ એપ્રિલ, ૨૦૨૦, સટક્યુલર નં. ૨૦/૨૦૨૦ તારિખ્પ મે, ૨૦૨૦ અને અન્ય સંબંધિત પરિપત્રો તેમજ જનરલ સટક્યુલર નં. ૦૯/૨૦૨૩ તારીક ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ અને માસ્ટરસરક્યુલરતારીખ૧૧ જુલાઈ, ૨૦૨૩ સાથે વંચાતા સિક્ચોરીટીઝ અને એક્સચેન્જળોર્ડઓફ ઇન્ડિયા(સેળી) દ્વારા જારી કરા ચેલસરક્યુલર તારીખ ૦૭ ઓક્ટોળર, ૨૦૨૩ અને આ મામલે એમસીએ અને સેળીદ્વારા જારી કરાચેલ અન્ય લાગુ અને સંબંધિત પરિપત્રો જો હોય તો (એક સાથે એજ્નએમ સંબંધિત પરિપત્રો તરીકે દર્શાવલે છે) ના અનુપાલન હેઠળ કંપનીની ૨૨મી એજીએમ બોલાવતી નોટીસમાં જણાવેલ કાર્ચો પાર પાડવા માટે ચોજાશે. કંપનીએ એજીએમ માટે વીસીની સવલત પુરી પાડવા માટે અને એજીએમ માટે ઇલેક્ટ્રોનિક વોટીંગ સવલત પુરી પાડવા માટે પણ સર્વિસ પ્રદાતા તરીકે બિગશેર સર્વિસીઝ પ્રાઈવેટ લીમીટેંડની નિમણંક

સભ્યો ફક્ત વીસી/ઓએવીએમ સવલત મારફ્ત એજીએમમાં હાજર રહી શકે છે અને ભાગ લઈ શકે છે. વીસી મારફત ભાગ લેનાર સભ્યોને એક્ટની ક્લમ ૧૦૩ હેઠળ કોરમની ગણતરી માટે ધ્યાનમાં લેવામાં આવશે.

એજીએમ સંબંધિત પરિપત્રોના અનુપાલન હેઠળ ૨૨મી એજીએમની નોટીસ અને નાણાંકિય વર્ષ ૨૦૨૪–૨૫નો વાર્ષિક અહેવાલ સભ્યો જેમના ઈમેઈલ એડ્રેસો કંપની√૨જીસ્ટ્રાર અને ટ્રાન્સફ્ટ એજન્ટો (આરટીએ એટલે કે બિગશેર સર્વિસીઝ પ્રાઈવેટ લીમીટેડ/ડિપોઝીટરી પાર્ટીશીપન્ટ( ટો ) (ડીપીઓ) પાસે રજીસ્ટર્ડ છે તેમને ફક્ત ઈમેઈલથી મોક્લવામાં આવશે. શેરહોલ્ડરોને રસ્મી મેજીએમની નોટીસ અને વાર્ષિક અહેવાલ મેળવવા માટે નીચેની સુચનાઓ અનુસરીને વહેલી તકે કંપની/આરટીએ/ડીપીઓ પાસે તેમના ઈમેઈલ આઈડીઓ અને મોળાઈલ નંબરો રજીસ્ટર/સુધારો/ચકાસણી કરવા વિનંતી છે:

િમર સંબંધિત કીપીઓ પાસે તમારા ઇમેઈલ આઈડી, મોબાઈલ નં. અને બેંક હોર્લ્ડીંગ એકાઉન્ટ વિગતો સુધારવા/ચકાસવા વિનંતી છે.

સભ્<del>યોએ નોંધ</del> લેવી <del>કે ૨૨મી એજીએમની નોટીસ અને નાણાંકિય</del> વર્ષ ૨૦૨૪–૨૫ નો વાર્ષિક અહેવાલ કંપનીની વેળસાઇટ www.deemrolls.com અને સ્ટોક એક્સરોન્જ એટલે કે એનએસઇ લીમીટેડની વેળસાઈટ www.nseindia.com ઉપર અપલોડ કરવામાં આવશે.

સભ્યો દારા રીમોટ ઈ–લોટીંગ/એજાએમ દરમિયાન ઈ–લોટીંગ માર ક્ત મતો આપવાની સવલત ળિગ શેર સર્વિસીઝ પ્રાઈવેટ લીમીટેડ દ્વારા પુરી પડાશે અને તેની વિગતવાર પ્ર<del>ક્</del>રિયા એજીએમની નો ટીસમાં આપવામાં આવશે. રીમોટ ઈ-વોટીંગનો સમચગાળો મંગળવાર, ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજસવારે ૯:૦૦ વાગ્યે ભારતીય સમયે શરૂ થશે અને ગુરુવાર, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ સાંજે૫:૦૦ લાગ્ચે ભારતીય સમયે પુર્ણ થશે. કટ –ઓફ તારીંખ શુક્રવાર, ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ ફીઝીકલ અથવા ડિમેટ સ્વરૂપે શેરહોલ્ડીંગ ધરાવતા કંપનીના સભ્યો ઉપરોક્ત ગાળા દરમિયાન રીમોટ ઈ–વોટીંગ અથવા એજીએમ દરમિયાન ઈ–વોટીંગ દ્વારા મત આપી શકે છે. ઉપરોક્ત માહીતી એમસીએ પરિપત્રો અને સેળી પરિપત્રોના અનુપાલન હેઠળ અને કંપનીન સભ્યોની જાણકારી અને લાભાર્થે જારી કરાઈ છે . બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ વતી અને માટે

સહી/-ફિર્લિ માળી

તારીખ: 03-06-૨૦૨૫ આગા અમદાવાદ

ક્રંપની રોક્રેટરી અને ક્રમ્પ્લાયન્સ અધિકારી (એસીએસ નં.૭૫૪૩૭)